

CIN : L17120GJ2008PLC053464

E-mail: info@shahlon.com

Web: www.shahlon.com

September 10, 2022

To,
The Manager
Dept. of Corporate Services
BSE Ltd.
25th Floor, P.J. Towers,
Dalal Street,
Mumbai - 400001

Sub: Publication of Notice of 14th Annual General Meeting, Book Closure, Dividend and Remote E-Voting information of the Company in Newspapers.

Ref: Shahlon Silk Industries Ltd. (BSE Script Code: 542862)

Dear Sir,

With regard to subject, please find enclosed herewith copies of newspapers in the matter of Notice of 14th Annual General Meeting, Book Closure, Dividend and Remote E-Voting advertisement, published in 'Gujarat Guardian' and 'The Financial Express' on 9th September, 2022.

Kindly update this information on your website for investors/general public.

Tel.: +91 261 2635551 - 53 & 57

Fax: +91 261 2635552

+91 261 4190200 / 291

Thanking you.

For Shahlon Silk Industries Limited

Hitesh K. GarmoraCompany Secretary

Encl.: As stated above

Date: 26,07,2022

કેનરા બેંક,

ડીમાન્ડ નોટીસ

વિષય : સિક્યુરીટાઈગ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સિયલ એસેટસ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ

લોનનો પ્રકાર લોનની રકમ તા. ૨૬.૦७.૨૦૨૨ ના રોજ થી વ્યાજની જવાબદારી

દારા અમારી તરકેણમાં સંબંધિત યોરય દસ્તાવેજોની કાર્યવાહી કરીને સિકયોર કરવામાં આવેલ તમે આપેલ

શરતો અને નિયમો મજબ નાણાં ભરવામાં નિષ્ફળ ગયા છો તો બેંકે તા. ૨૩.૦૦.૨૦૨૨ ના રોજ એનપીએ તરીકે

જાહેર કરેલ છે. આર્થી અમે આપને સદરહું કાયદાના સેકશન ૧૩(૨) અનુસાર નોટીસ આપીએ છીએ કે આપે

સંપૂર્ણ ૨કમ રૂા. ७,००,૪૦૨.૯૪ (રૂા. સાત લાખ ચારસો બે અને ચોરાણુ પૈસા પુરા) સાથે પૂરેપૂરી ભરપાઈ

કરવા અને આજ સુધીનું વ્યાજ તથા અન્ય ખર્ચાઓની રકમ આ નોટીસની તારીખ થી દિન ૬૦ માં ભરપાઈ કરી

દેવા. એમા કસુર થયેથી બેંક સદરહું કાયદાના સેકશન ૧૩(૪) મુજબ કોઈપણ અથવા તમામ અધિકારનો

મિલકતનો કોઈપણ રીતનો વ્યવહાર કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. આ અમને સદરહું કાયદાથી મળેલ

અને / અથવા ચલણમાં હોય તેવા અન્ય કોઈ કાયદા દ્રારા મળેલ કોઈ અન્ય અધિકારોના પૂર્વગ્રહે સિવાય આપેલ

ઉપરાંત તમને અમારી અગાઉથી મંજુરી લીધા વગર યાદીમાં દર્શાવેલ સિક્યોર્ડ મિલકતમાંથી કોઈ પણ

આ સિકયોર્ડ અસ્કયામત છોડવવા માટે સમય આપેલ છે તે અંગે સરફેસી કાયદાની કલમ ૧૩ ની પેટા

તમને રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. દ્રારા આ માંગણા નોટીસ તમને શાખાના રેકોર્ડ પ્રમાણે તમારા છેલ્લા સરનામે

ગિરવે રાખેલ / હાઈપોથીકેટેડ અસ્કયામતોની વિશેષ વિગતો નીચે જણાવેલ છે.

અલથાણ શાખા, સુરત

આથી નીચે સહી કરનાર **કેનરા બેંક** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ

રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ,

૨૦૦૨ (નિયમ ૫૪ ઓફ ૨૦૦૨) (ત્યાર બાદ એકટ તરીકે ઓળખાય છે) તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ

(એન્ફોર્સમેન્ટ) નિયમો, ૨૦૦૨ના નિયમ ૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની ૩એ ડીમાન્ડ

નોટીસ હેઠળ **તા. ૨७.૦૫.૨૦૨૨** ના રોજ ઉધારકર્તા **શ્રી અમીરાજ કુમ્મર** ને જારી કરીને ડીમાન્ડ નોટીસમાં

જણાવેલ રૂા. ૧૬,૧૯,૯૬૯.૧૬ (રૂા. સોળ લાખ ઓગણીસ હજાર નવસો ઓગણસીત્તેર અને સોળ

આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ

વ્યવહાર ન કરવાની ચેતવર્ણો આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર

કેનરા બેંક, અલથાણ શાખા ની રકમ રૂા. ૧૬,७૨,७૪૧.૯૫ (રૂા. સોળ લાખ બોર્વેર હજાર સાતસો

એક્તાલીસ અને પરચાણું પૈસા પુરા) વત્તા તા. ૦૨.૦૯.૨૦૨૨ ના સુધીનું અને વ્યાજ સાથેના બોજાને

તથા કલમ ૧૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી

પ્લોટ નં. ૩૪, એરીયાનું ક્ષેત્રફળ ૪૩.૮૯ સ્કે.મી., અવિભાજીત હકક સાથેનો સીઓપી અને રોડ નું

ક્ષેત્રફળ ૩૪.૫૩ સ્કે.મી., કુલ ક્ષેત્રફળ ૭૮.૪૨ સ્કે.મી., ''સાંઈ પૂજન રો હાઉસ'' થી જાણીતી સોસાયટી,

મોજે ગામ - ઓલપાડ, સબ^{જી}લ્લો - ઓલપાડ, જીલ્લો - સુરત. **ચતુઃ સીમા :- ઉત્તરે** : જોડેનો પ્લોટ નં. ૩૩,

ક્બજા નોટીસ

રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨

તથા સિંક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ના નિયમ-૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૪.૦૫.૨૦૨૧ ના રોજ ડીમાન્ડ નોટીસ <mark>શ્રીમતી સોનલ વિજય સાલુંકે, શ્રી વિજય નાના</mark>

સાલુંકે અને તેમના જામીનદારો શ્રી આનંદા બલિરામ સાલુંકે ને નોટીસ માં દર્શાવેલી રકમ રા. ૯,૯૭,૧૯૫/-

(રૂા. નવ લાખ સત્તાણું હજાર એક્સો પચ્ચાણું પુરા) + તા. ૨૭.૦૩.૨૦૨૧ ના રોજ થી વ્યાજ + લીગલ અને

અન્ય ખર્ચાઓ વગેરે સાથે કથિન નોટીસ તારીખથી ૬૦ દિવસની અંદર ભરી જવાનો આદેશ કરવામાં આવ્યો

ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ

નાપવામાં આવે છે કે અધિનિયમ[ે]૧૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) <mark>ર</mark>ૂલ

૨૦૦૨ના રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ તા. ૦૫.૦૯.૨૦૨૨ ના રોર્જ નીંચે

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન

કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **બેંક ઓફ બરોડા,**

ણા કંભારીયા શાખા ની રેકમ રા. ૧૨,૦૩,૨૬७.७૪ (રા. બાર લાખ ત્રણ હજાર બસ્સો સડસઠ અને

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ (૮) તથા કલમ

સ્થાવર મિલકતનું વર્ણન

શ્રીમતી સોનલ વિજય સાલું કે અને શ્રી વિજય નાના સાલું કે ના નામની તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતનો

પ્લોટ નં. ૩૨૨, સાઈટ મુજબનું આશરે ક્ષેત્રફળ ૪૮.૦૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૦.૧૩ સ્કે.મી. અને મંજુર કરેલ

પ્લાન મુજબનું આશરે ક્ષેત્રફળ ૪૨.૦૫ સ્કે.મી., અવિભાજીત હકક સાથેના રોડ અને સીઓપીનું આશરે ક્ષેત્રફળ

૨૧.૮૭ સ્કે.મી., "રાશી રેસીડેન્સી", જે સ્થિત જમીનનો બ્લોક નં. ૧૨૪ (રેવન્ય સર્વે નં. ૧૧૫), જેનં ક્ષેત્રફળ

૩૩૧૪૫.૦૦ સ્કે.મી., ગામ - કારેલી, સબ જીલ્લો - પલસાણા, જીલ્લો - સરત, ચતઃસીમાઃ- ● ઉત્તરે ઃ પ્લોટ

નં. ૩૨૩, ● દક્ષિણે ઃ પ્લોટ નં. ૩૨૧, ● પૂર્વે ઃ પ્લોટ નં. ૩૫૯, ● પશ્ચિમે ઃ સોસાયટીનો આંતરીક રોડ.

-**યુંમોત્તેર પૈસા પુરા)** + ચડત વ્યાજ સાથે + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરેના બોજાને આધીન રહેશે.

૧ ૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો.

આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ

પુણા કુંભારીયા શાખા : પ્લોટ નં. ૧૨-૧૩, ટાટા મોટર્સ ઓટો

પોઈન્ટની પાસે, મું. મગોબ, તાલુકો - ચોર્યાસી, જીલ્લો - સુરત,

પીન-૩૯૫૦૧૦, ફોન નં. ૦૨૬૧-૨૬૪૦૦૨૯, ૨૬૪૦૦૦૩૦.

દક્ષિણ : જોડેનો પ્લોટ નં. ૩૫, પૂર્વે : જોડેનો પ્લોટ નં. ૪૫, પશ્ચિમે : સોસાયટીનો રોડ.

ેઉધારકર્તા ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તા અને જાહેર જનતાને નોટીસ

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ (૮)

પૈસા પુરા) હાઉસીંગ લોન એકાઉન્ટ સાથે ૬૦ દિવસની અંદર બાકી રકમ સહિત ચુકવવા જણાવેલ.

અધિકૃત અધિકારીએ તા. ૦૨.૦૯.૨૦૨૨ ના રોજ નીચે જણાવેલ મિલકતોનો કબજો લઇ લીધેલ છે.

પઝેશન નોટીસ (સેક્શન ૧૩(૪) (સ્થાવર મિલક્ત માટે)

भिवडतनुं विगतवार वर्शन

ગેરવે મકેલ ઘર, જય માં એપાર્ટમેન્ટ. કલેટ નં

સહી/-, અધિકૃત અધિકારી, કેનરા બેંક

અધિકૃત અધિકારી, કેનરા બેંક

અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા

૩૦૩, ઉમરગામ, વલસાડ, જીલ્લો ૩૯૬૧૬૫.

અમારી ઉમરગામ શાખા તરફથી આપે નીચે મુજબની લોન / અન્ય સગવડો મેળવેલ છે.

રહેણાંક ૧ : સી-૪૧૨, કાલેશ્વર એપાર્ટમેન્ટ, સાંઈબાબા મંદિર પાસે, દત્તાનગર, વસઈ,

રહેણાંક ૨ : જય માં એપાર્ટમેન્ટ, ફલેટ નં. ૩૦૩, ઉમરગામ, વલસાડ, જીલ્લો - ૩૯૬૧ ૬૫.

સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ - ૨૦૦૨ની ધારા ૧૩(૨) હેઠળ માંગણા નોટીસ જારી કરી છે.

e, co, ooo/-

કલમ (૮) હેઠળની જોગવાઈ તરફ તમારૂં ધ્યાન દોરીએ છીએ.

િગરવે/હાઈપોથીકેટેડ અસ્કથામત આઈટમ મુજબ

ટાઈટલ હોલ્ડરનું નામ

: શીતલ ગણેશ લાક

केनरा बैंक 🗱 Canara Bank 🛮 डेनरा ॲंड,

નાલાસોપારા (પૂર્વ), નાલાસોપારા, મહારાષ્ટ - ૪૦૧૨૦૯.

ઉમરગામ શાખા

केनरा बैंक 🐼 Canara Bank

सिंडिकेट बैंक Syndicate Bank

શીતલ ગાગેશ લાક

હાઉસીંગ લોન

४५3**१९१**९००००४०

પોસ્ટથી મોકલેલ છે.

તારીખ : ૨૬.૦७.૨૦૨૨ સ્થળ : સુરત

આધીન રહેશે.

મેળવી શકો છો.

તારીખ : ૦૨.૦૯.૨૦૨૨, સ્થળ : સુરત

જણાવેલ મિલકતનો **પ્રત્યક્ષ કબજો** લઇ લીધેલ છે.

તારીખ : ૦૫.૦૯.૨૦૨૨, સ્થળ : સુરત

Bank of Baroda

former VIJAYA


જાહેર નોટીસ

આથી જાહેર નોટીસ થકી જણાવવામાં આવે કે અમો ૧. ગોતમભાઇ ચંદભાઇ પટેલ, ૨. નીતા **ગોતમભાઇ પટેલ** , રહેવાસી: બી/૩૯૦ , જલારામ નગર , ગુ.હા.બોર્ડ , પાંડેસરા , સુરત નાઓના અમારા પુત્ર ન **રાહુલ ગોતમભાઇ પટેલ** થી અલગ રહીએ છીએ અને અમારો પુત્ર **રાહુલ ગોતમભાઇ પટેલ** અમારા કહ્યામાં ાને જેથી અમોએ તેઓ સાથેના તમામ આર્થિક સામાજીક સંબંધો તોડી દીધેલ છે અને તેઓને તમામ સંચુક નેમજ ખાનગી મિલકતોમાંથી બેદખલ કર્યા છે અને કોઇપણ વ્યક્તિ કે સંસ્થા તેઓ સાથે કોઇપણ આર્થિક કે ામાજીક વ્યવહાર કરશે તો તેની કોઇપણ જવાબદારી અમારી રહેશે નહીં. જેની તમામ એ નોંધ લેશો. લિ. ૧. ગોતમભાઇ ચંદુભાઇ પટેલ મો. ૯૯૨૫૦૨૮७७૨ ૨. નીતાબેન ગોતમભાઇ પટેલ રહેવાસીઃ બી/૩૯७, જલારામ નગર, ગુ.હા.બોર્ડ, પાંડેસરા, સુરત.

જાહેર નોટીસ એસ.સી.સાવલીયા, સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, કામરેજની કોર્ટમાં નં.એમએજી/જ.મ.પ્ર./રજી.નં.૧૨૯/૨૦૨૨ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ, કામરેજ પ્રાંત કચેરી

વાદી : રેવાબેન છનાભાઇ રાઠાઝ, રહે. આમલી ફળીયું, બગુમરા, તા.પલસાણા,જી.સુરત. વિરુદ્ધ કામરેજ,તા.કામરેજ,જી.સુરત. વાળાઃ જન્મ-મરણ નોંધણી રજીસ્ટ્રારશ્રી, બગુમરા, ગ્રામ પંચાયત બગુમરા, તા.પલસાણા, જી.સુરત ંતા. ૦૬/૦૯/૨૦૨

વિષય: જન્મ-મરણ અધિનિયમની કલમ-૧૩(૩) મુજબ જન્મની નોંધણી કરાવવા બાબત. આથી આ જાહેર નોટીસથી લાગતા વળગતા તમામ ઇસમોને જણાવવામાં આવે છે કે સદર અરજી અરજદારશ્રી રેવાબેન છનાભાઇ રાઠોડ, રહે. આમલી ફળીયું, બગુમરા, તા.પલસાણા,જી.સુરતના દોહિતર જયેશભાઇ છીબાભાઇ રાઠોડનો જન્મ તા.૧૧/૦૬/૧૯૯૩ ના રોજ બગુમરા, તા.પલસાણા, જી.સુરત ખાતે થયેલ છે અને તેઓના જન્મની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઇ ભુલ અને શરતચુકથી કરાવવાની રહી ગયેલી છે. તેની નોંધણી કરાવવા અત્રેની કોર્ટમાં અરજી દાખલ કરેલ છે. તો સદર જન્મની નોંધણી કરાવવા સામાવાળાને હુકમ કરવા સામે કોઇપણ ઇસમને વાંધો કે તકરાર હોય તો અત્રેની કોર્ટમાં નોટીસ પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં યા તો મુદ્દત તા.૧૧/૧૦/૨૦૨૨ ના રોજ વાંધો રજુ કરવો. જો વાંધો નહી આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્ચવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઇસમોએ નોંધ લેવી. આજ રોજ તા. ૦૬/૦૯/૨૦૨૨ ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.



<mark>જાહેર નોટીસ</mark> મે. વાંસદાના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબશ્રીની કોર્ટમાં, મુ.વાંસદા અરજદાર : સુધાબેન રાસલુભાઇ વાઘેરા તે મગનભાઇ રાઠોડની પુત્રી ફોજદારી પરચુરણ અરજ નંઃ ૩૨/૨૦૨૬ ે.આ.વ.ઃ ૪૪, દાંદોઃ ઘરકામ, રહે.ઃ રંગપુર, તા.વાંસદા, જી.નવસારી અરજદારના વિ.વ.શ્રી.પી.વી.કુંવર

મુળ રહે.:સીતાપુર,તા.વાંસદા,જી.નવસારી વિરૂધ્ધ સામાવાળાઃ તલાટી કમ મંત્રીશ્રી,સીતાપુર, ગ્રામ પંચાયત સીતાપુર, તા.વાંસદા,જી.નવસારી. આથી હિત ધરાવનાર પક્ષકારોને આ નોટીસથી જણાવવામાં આવે છે કે, ઉપરોક્ત નંબરના કામે અરજદારન બેન સ્વ.ઉલઠીબેન મગનભાઇ રાઠોડ નું મરણ મોજે ગામઃ સીતાપુર, <u>વા.વાંસદા, જી.નવસારી,</u> મુકામે તા.૨૦/૦૧/૧૯૮૧ ના રોજ થયેલાનું જણાવી મરણની નોંધ રેકર્ડ દફ્તરે થયેલ ન હોય, તે માટે હુકમ મેળવવા અત્રે કોર્ટમાં અરજી કરેલ

છે. જેની સામે જે કોઇને વાંધા રજુ	કરવા હોચ તેમણે જાહેરાત પ્ર	સિધ્ધ થયે દિન્	ન-૩૦માં વાંદા રજુ કરવા, અગર
ાંધા રજૂ ન થાય તો નામદાર કોર્ટ	આગળની કાર્ચવાહી હાથ ધ	રી યોગ્ય તે હુક	મ ફરમાવશે, જેની જનતાએ નોંદ
આજ તારીખ <u>૧૧મી એપ્રિલ</u>	<u>સને ૨૦૨૨</u> ના રોજ મારી સ	ાહી તથા કોર્ટેન્	નો સિક્કો કરીને આપ્યું.
તૈયાર કરનાર	મુકાબલ કરનાર		<u>લુક્રમથી</u>
(એ.એસ.પટેલ)	(એચ.એ.હિસુ)		(ચુ.ચુ.પરમાર)
આસીસ્ટન્ટ	આસીસ્ટન્ટ	(કોર્ટનો)	ઇ.ચા. રજીસ્ટ્રાર
જ્યુડી.મેજી.ફ.ક.કોર્ટ,	જ્યુડી.મેજી.ફ.ક.કોર્ટ,	સિક્કો /	જ્યુડી.મેજી.ફ.ક.કોર્ટ,

પરિશિષ્ટ-૪ (નિચમ-૮(૧))	પાઇન્ટના પાસ, મું. મળાળ, તાલુકા - ચાવાસા, પીન-૩૯૫૦૧૦, ફોન નં. ૦૨૬૧-૨૬૪૦૦: કબજા નોટીસ	જીલ્લા - સુરત, .૯, ૨૬૪૦૦૦૩૦. (સ્થાવર મિલકત માટે)
बैंक ऑफ़ बड़ौदा	પુણા કુંભારીચા શાખા : પ્લોટ નં. ૧૨-૧૩, ટ	ાટા મોટર્સ ઓટો
Bank of Baroda	પોઈન્ટની પાસે, મું. મગોબ, તાલુકો - ચોર્યાસી,	જલ્લો સરક

આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ના નિયમ-૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. **૦૪.૦૫.૨૦૨૧** ના રોજ ડીમાન્ડ નોટીસ **શ્રી ભરત ગંગારામ એશી અર્ન** શ્રીમતી મીરાબેન ગંગારામ એશી ને નોટીસ માં દર્શાવેલી સ્ક્રમ રૂા. ૧૩,૩૫,૧૪૫/- (રૂા. તેર લાખ પાંત્રીસ **હજાર એક્સો પિસ્તાલીસ પુરા)** + તા. ૦૬.૦૩.૨૦૨૧ ના રોજ થી વ્યાજ + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરે સાથે કથિન નોટીસ તારી ખથી ૮૦ દિવસની અંદર ભરી જવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ મિક્યરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) ૩લ ૨૦૦૨ના રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ તા. ૦૫.૦૯.૨૦૨૨ ના રોજ નીચે જણાવેલ મિલકતનો **પ્રત્યક્ષ કબજો** લઇ લીધેલ છે.

. ઉધારકર્તાને વિશેષ ૩૫થી તથા જાહેર જનતાને આથી સદરહ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **બેંક ઓફ** બરોડા, પુણા કુંભારીયા શાખા ની રકમ રૂા. વપ,૯૨,૫૦૪.૫૯ (રૂા. પંદર લાખ બાણું હજાર પાંચસો ચાર **અને ઓગણસાઢીઠ પૈસા પુરા)** + ચડત વ્યાજ સાથે + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરેના બોજાને આધીન રહેશે.

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ (૮) તથા કલમ ૧૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો.

શ્રી ભરત ગંગારામ એશી અને શ્રીમતી મીરાબેન ગંગારામ એશીના નામની તમામ ભાગ અને હિસ્સા સાથેની

જમીનનો <mark>પ્લોટ નં. ૧૧૧,</mark> જેનું આશરે ક્ષેત્રફળ ૬૦.૨૮ સ્કે.મી., "**વિદ્યા રેસીડેન્સી વિભાગ - ૧",** ફાળવેલ જમીનનું ક્ષેત્રફળ ૧૪૮૬૫ સ્કે.મી., બ્લોક નં. ૩૮૪ એટલે કે રેવન્યુ સર્વે નં. ૧૦૬/૧/બી, ૧૦૬/૧/કે, ૧૦૯ પૈકી અને ૧૧૦/૨, ગામ - કારેલી, તાલુકો - પલસાણા, જીલ્લો - સુરત. ચતુઃસીમાઃ- ● ઉત્તરે ઃ પ્લોટ ાં. ૧૧૦, ● દક્ષિણો ઃ પ્લોટ નં. ૧૧૨, ● પૂર્વે ઃ સોસાયટીનો રોડ, ● પશ્ચિમે ઃ બ્લોક.

તારીખ : ૦૫.૦૯.૨૦૨૨, સ્થળ : સુરત અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા



સ્ટેશન રોક, સુરત શાખા

સત્કાર હોટલ બિલ્ડીંગ, દિલ્હી ગેટ પાસે, ઉના પાણી રોડ, સુરત-395003. ફોન : 0261-2423279. E-mail:stationrdsurat@unionbankofindia.com

િકમાન્ડ નોટીસ (સરફેસી એક્ટ, 2002ના સેક્શન 13ના સબ સેક્શન (2) અંતર્ગત) રેફ : રીકવરી/2022-23/2 | સ્થળ : સુરત

પ્રાત, 1. મેસર્સ હર્ષિતા ફાઇબર (કરજદાર) - (માલિક : શ્રીમતી રજની સત્યેન્દ્રસિંહ ગુપ્તા) 2. શ્રીમતી રજની સત્યેન્દ્રસિંહ ગુપ્તા (કરજદાર) મેસર્સ હર્ષિતા ફાઇબરના માલિક અને મૃતકના જામીનદાર કાનુની વારસદાર/પત્ની એટલે કે શ્રી સત્યેન્દ્રસિંહ જસવંતસિંહ ગુપ્તા 3. શ્રી હિમાંશુ ગુપ્તા (મૃતક બાંચધરી આપનાઓ પુત્ર એક કાનૂની વારસ છે. શ્રી સત્યેન્દ્રસિંહ જસવંતસિંહ ગુપ્તા મુ. એમ-25, સુપર ટેક્સ ટાવર, કિન્નરી સિનેમા સામે, રીંગ રોડ, સુરત-395 003, ગુજરાત અહીં પણ : ફ્લેટ નં .3-બી, પોદાર એવેન્ચુના ટાવર 'સી'ના શ્રીજ માળ, જોગર્સ પાર્ક, થુનિયન પાર્ક લેન, હોડ દોડ રોડ, ભટાર, સુરત-395 007, ગુજરાત

સુવિધાઓના સંબંધમાં - NPA તરીકે વર્ગીકૃત કરાયેલ. સરફેસી એક્ટ , 2002 ના 13(2) હેઠળની તા .06-11-2021 ની ડિમાન્ડ નોટિસ અને ઉપરોક્ત નોટિસના અનુસંધાનમાં લેવામાં આવેલી અન્ય તમામ કિચાઓ (જે કોઈ હોય તો) ના અધિનિયમ હેઠળ , અમે આથી આ નોટિસને ચાદ કરીએ છીએ . છે કે તમારા એકાઉન્ટ/એકાઉન્ટ્સ એટલે કે મેસર્સ હર્ષિતા ફાઇબર (શ્ર

મત્યેન્દ્રસિંહ ગુપ્તાની માલિકી) એ અમારી શાખામાંથી નીચેની ક્રેડિટ સુવિધાઓનો લાભ લીધો છે. સુવિધાનો પ્રકાર લોન મંજૂર (રૂ.માં) ઉત્તેજક ROI ખાતા નંબર

CCUTR	311305040091038	2,00,00,000.00	12.20%
		મેકાઉન્ટ્સ એટલે કે મેસર્સ હર્ષિત	
10-2021ના રોજ NPA ર	એકાઉન્ટ [ૅ] તરીકે વર્ગીકૃત કરવાઃ	માં આવ્યા છે , કારણ કે બાકી લેણાં	/હપતા/વ્યાજની
		।। ਦੀਕ, ੩. 2,28,05,694.60 (
અંહાવીસ લાખ પાંચ હવ	ત્રર છસો ચોરાણું અને સાંઠ પૈ	સા પુરા) 31-07-2022 સુધી વ	સૂલવામાં આવેલ
વ્યાજ સહિત નીચે બતાવ	થા પ્રમાણે તમારા ખાતામાં બાકી	છે:	•

હાલની તારીખે કુલ NPAની તારીખે કુલ 01-10-2021 01-10-2021 웹 थी 31-07-2022 31-07-2022 બાકી રકમ બાકી રકમ (สม.30-09-2021 સુધી દંડ (สม.31-07-2022 સુધી લાગુ ન થયેલ પ્રધીના વ્યાજ સહિત) લ્યાજ વગરનું વ્યાજ सुधीना व्याष्ट्र सहित)

311305040091038 2,05,25,492.60 19,64,764.00 3,15,438.00 2,28,05,694,60 મમારી વારંવારની તમારી માંગણીઓ છતાં, નંબર 1 અને 2 કરજદાર હોવાથી ખાતામાં બાકી રહેલી રકમની કુલ રકમ ચૂકવવામાં નિષ્ફળ રહ્યાં અને કરાર આધારિત જવાબદારીઓનું નિકાલ કરવામાં અવગણના કરી અને ડિફોલ્ટ થઈ.

મત્યેન્દ્રસિંહ જસવંતસિંહ ગુપ્તાએ રૂ. 2,00,00,000.00 (**માત્ર બે કરોડ રૂપિયા**). એકની જાણકારીમાં એવું આવ્યું છે કે શ્રી સત્યેન્દ્રસિંહ જસંવંતસિંહ ગુપ્તા 13-07-2021 ના રોજ સમાપ્ત થઈ ગયા છે. તમે મૃતક જમીનદારના કાનૂની વારસદાર તરીકે નંબર 3 , સત્યેન્દ્રસિંહ જસવંતસિંહ ગુપ્તા , સ્વર્ગસ્થ શ્રી સત્યેન્દ્રસિંહ જસર્વતસિંહ ગુપ્તાના વ્યવસાય અને જામીનગીરીઓ વારસામાં મેળવી છે. તમે નંબર 3 તમારી સાથે શ્રી સત્યેન્દ્રસિંહ જસર્વતસિંહ ગુપ્તાના કાયદેસરના વારસદાર તરીકે , નંબર 1 અને 2

અહીં. ઉલ્લેખનિય છે કે ઉપરોક્ત સવિધાઓમાં બેંકના લેણાંની ચકવણીની વિધિવત ખાતરી સ્વ

ઉપરોક્ત જવાબદારીઓ અને લેણાંની નિકાલ કરવા માટે જવાબદાર છો भमे तमने सिझ्योरिटाएप्रेशन એन्ડ रिइन्स्ट्र्ड्शन ओइ इाएनान्शियस એसेट्स એन्ડ એन्ફોર્સમેન્ટ ઓફ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ , 2002ની ક્લમ 13 (2)ની શરતોમાં આથી રૂ.ની રકમ ચૂકવવા માટે આહ્યાન કરીએ છીએ . રૂા . 2 ,28 ,05 ,694 .60 (રૂપિયા બે કરોડ અઢાવીસ લાખ પાંચ હજાર છસો ચોવીસી અને સાઠ પૈસા માત્ર) એકસાથે વસૂલ ન કરાચેલ વ્યાજ (જો કોઈ હોય તો), ખર્ચ અને ખર્ચ અને ખર્ચ અને ખર્વ અને ખર્વ અને ખર્વ અને ખર્વ અને ખર્ચ અને ખર્વ અને ખરત અને ખર્વ અને ખર્વ અને ખર્વ અને ખર્વ અને ખર્વ અને ખર પ્રતિબંધિત થર્કશું. ઉપરોક્ત અધિનિયમ હેઠળ આપવામાં આવેલ કોઈપણ અથવા તમામ અધિકારોનો ઉપયોગ કરીને બેંકની તરફેણ કરો.

સરક્ષિત સંપત્તિઓનું વર્ણન

ક્રમ નં.	વર્ણન	नी भाલिडी
1.	M-25, સુપર ટેક્સ ટાવર, મેસર્સ હર્ષિતા ફાઇબર ના એકમમાં પડેલો અનુમાનિત સ્ટોક. કિન્નરી સિનેમા સામે , રીંગ રોડ, સુરત - 395 003, ગુજરાત	મેસર્સ હર્ષિતા ફાઇબર
2.	હાયપોથેકેટેડ બુક - મેસર્સ હર્પિતા ફાઇબર્સનું દેવું	મેસર્સ હર્ષિતા ફાઇબર
3.	તમામ ભાગ અને હિસ્સા ધરાવતી મિલકત ફ્લેટ નં.3-બી, સુપર બિલ્ટ અપ 4000 ચોરસ ફૂટ છે. એટલે કે 371.75 ચોરસ મીટરની સમકક્ષ. અને માપન કાર્પેટ વિસ્તાર 2421.25 ચોરસ ફૂટ. એટલે કે 225.02 ચોરસ મીટરની સમકક્ષ. રેસિકેન્શિયલ હાઉસિંગ કેમ્પસેના ટાવર સીના ત્રીજા માળે પોફાર એવન્યુ તરીકે ઓળખાય છે અને તેનું નામ છે, એકસાથે-નીચેની જમીન અને બાજુના કોમન રોડ અને સીઓપી વગેરમાં પ્રમાણસર અવિભાજિત હિસ્સા સાથે વિસ્તાર 63. 92 ચોરસ મીટર સ્થિત છે. 1516.37 ચોરસ મીટર વિસ્તારના ફાઇનલ પ્લોટ નંબર 101 ના N.A. જમીન ધરાવતા સબ પ્લોટ નંબર 7-B પર બાંધવામાં આવ્યું છે. ના ટી.પી. રેવન્યુ સર્વે નંબર 71ની સ્કીમ નં.27 (ભટાર-મજુરા) અને 82 માપન 26001 ચોરસ મીટર છે. મોજે ગામ. ભટાર, પેટા જિલ્લો સુરત શહેર, જિલ્લો	શ્રીમતી રજની સત્યેન્દ્રસિંહ ગુપ્તા

) ਮੁਫ਼ੇਵਯਾਰੀ કੁਵੀ ਗੇਂध લેશો કੇ જો ਰਮੇ 60 ਵਿਕਲਮਾਂ ਆ ਵੁકੁਮ ਅਵਪਾਈ ਭਵਕਾਮਾਂ ਰਿਖ਼ਤਾ ਹੋ ਹੈ। ਐਂਡ કાયદાના તમામ હક્કો હેઠળ પગલા લઈ જો સુરક્ષિત અક્સ્થામતોનું વેચાણ દ્વારા પણ બાકી લેણાં સંતોષકારક રીતે ન ભરપાઈ થયા તો અમોને તમારી પાસેથી બાકીની રકમ ની વસુલી માટે તમારી સાથે

કોર્ચના કાચદા/ડેબ્ટ રીક્વરી ટ્રીબ્યુનલ કાચદાકીય પગલા લેવાની ફરજપડશે. !) તમને વિનંતી કરવામાં આવે છે કે કલમ 13(13) કાચદા હેઠળ , આ નોટીસ મળ્યા બાદ બેંકની જાણ બહાર અહીં જણાવેલ મિલકતનો ફક્ત દાંદ્યાના સામાન્ય કામકાજ માટેના ઉપયોગ સિવાય આ મિલકતનો નિકાલ અથવા વેચાણ કરી શકશો નહીં. નોંધ લેશો કે આ કાયદાના ઉલ્લંઘન કરશો તો ગંભીર પરિણામ ભોગવવું પડશે.

) તમને જણાવવામાં આવે છે આ નોટીસનું ધ્યાન આકૃષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્ચાદામાં સેક્શન 13ના સબ સેક્શન (8) હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતની બાકી લેણા ભરપાઈ કરી પાછી

નોંધનીય છે કે, સિક્યુરીટાઈપ્રેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ફ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટ, 2002 હેઠળ અમારી અગાઉની તમામ નોટીસો અને લેવાયેલા પગલાં (જે કોઈ હોય તો), ઉપરોક્ત અધિનિયમની કલમ 13(2) હેઠળ આ સુધારેલી અને તાજી ડિમાન્ડ નોટીસ થકી તે બિનઅસરકારક અને પાછી ખેંચી લેવામાં આવે છે. તમારો વિશ્વાસ તમારો વિશ્વાસુ

રાજેશ ચોપરા, મુખ્ય પ્રબંધક અધિકૃત અધિકારી, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા dl. 06-08-2022

Printed by Manojbhai Laljibhai Mistry at GUARDIANPRESS B-17/2, Hojiwala Industrial Estate, S

સરત જીલ્લાના કામરેજ તાલકાના ગામ પાસોદરાના રે.સ.નં. ૫૮. ૬૦. ૬૩. તથા ૭૨. બ્લોક નં. ૬૦ વાળી આશરે ૦૬-૪૦-૯૬ સે.ચો.મી.યાને ૬૪૦૯૬ સ.ચો.મી. (પ્રમોલગેશન/રીસર્વે બાદ નવો બ્લોક નં.૭૦)વાળી જમીન તથા ડીસ્ટ્રીકટ સુરત, તાલુકા કામરેજ, મોજે ગામ પાસોદરા, રેવન્યુ સર્વે નં. ૫૯, બ્લોક નં. ૬૧ વાળી આશરે હે.આરે.૦૧-૫૨-૨૧ સ.ચો.મી. યાને ૧૫૨૨૧ સ.ચો.મી. (પ્રમોલગેશન/રીસર્વે બાદ નવો બ્લોક નં.૭૧)વાળી જમીન મળી કુલ્લે ૭૯૩૧૭ સ.ચો.મી. માં રહેશાંકનાં હેતુ માટે શ્રી ગઢપુર ટાઉનશીપ (વરાછા)કો.ઓ.હા.સો.લી. (જે સહકારી કાયદા મુજબ સુરત જીલ્લા સહકારી મંડળી, સુરત કચેરીમાં રજી.નંબર ઘ-૨૨૯૯૩ થી તા.૧૨/૦૨/૨૦૦૮ નાં રોજ નોંધાયેલ એક સહકારી ગૃહેંમંડળી છે.)જે એક સહકારી મંડળી દ્વારા આયોજીત 'શ્રી ગઢપુર ટાઉનશીપ' ામથી ઓળખાતી વસાહતમાં આવેલ સી-૪ બિલ્ડીગમાં પહેલામાળ પર આવેલ ફ્લેટ નેં.૧૦૧ વાળી નીલકતના માલિક શ્રીમતી લાભુબેન દયાળભાઈ વીરાણી તથા શ્રીમતી રેખાબેન ભરતભાઈ ઘેલાણી હોવાનું જણાવે છે, તેમના જણાવ્યા મુજબ સદર મિલકત સી-૪ બિલ્ડીગમાં પહેલામાળ પર આવેલ ફ્લેટ નં.૧૦૧ ના ચેન ઓફ ડોક્યુમેન્ટમાં સોસાયટી તરફેથી આપવામાં આવેલ ઓરીઝનલ શેર સટીફીકેટ જેનો સભ્ય નં. ૪૭૪ વાળા પાંચ (૫)નંગ શેર અંગેનુ સર્ટીફિકેટ આપવામાં આવેલ હતુ જે શેર સટીકીકેટ તથા સદરહં મીલકતનો એલોટમેન્ટ લેટરના ડોકયુમેન્ટ સદરહુ મીલકતના માલિકોના ઘરેથી કયાંક ગુમ થયેલ છે. જે શોધખોળ કરતા આજદિન સુધી મળી આવેલ નથી. સદર મીલકતો અમોના અસીલ સદરહુ મીલકતના માલિકો પાસેથી ખરીદ કરી તેની ઉપર લોન મેળવવા માંગતા હોય. ઉપરોક્ત ઓરીઝનલ શેર સટીફ્રીકેટ તથા તે મીલકતનો એલોટમેન્ટ લેટર જો કોઇ વ્યક્તિ. નાંણાકીય ધીરાંણ આપનાર કોઇ ખાનગી

ક સરકારી સંસ્થા, બેંકમાં જમા હોય તો તે અંગે આ નોટીસના દિન-૭ માં અમોને લેખીત જાણ કરવી.

મુદત વીત્યે મજુકુર ડોક્યુમેન્ટ ગુમ થયેલ છે અને કોઇ સંસ્થા કે વ્યક્તિ પાસે જમા નથી તેમ માની

નાગળની કાર્યવાહી કરવામાં આવશે અને મુદત બાદ કોઇની કોઇપણ જાતની તર-તકરાર ચાલશે નહી

અને ઉપરોક્ત મિલક્તના સંપુર્શ ટાઇટલ ચોર્ખ્ખા માની લેવામાં આવશે. તેની તમામે નોંધ લેવી.

જાહેર નોટીસ

ઓફિસ : ૩૦૩, ત્રીજો માળ, સમર્થપાર્ક કોમ્પલેસ,અર્ચના સ્કુલ પાસે, પુના બોમ્બે માર્કેટ રોક, સુરત.

કેતન જી. પાંચાણી એકવોકેટ

અહ્રક હરાજી

આથી સંબધકર્તા ઇસમો / વેપારીઓ તેમજ ઇજારદારોને જણાવવાનુ કે, મ.પો.કમિશ્નર ''એફ' ીવીઝન સુરત શહેર હસ્તકના પો.સ્ટે.ના ગોમાંસ/ગોવંશના કાયદા સંદર્ભે ખાલસા કરેલ વાહનોની જે તે સ્થીતીમાં **તા. ૨७/૦૯/૨૦૦૨** ના રોજ જાહેર હરાજી રાખવામાં આવનાર છે. હરાજીમાં ભાગ લેતા પહેલ સબંધીત ઇસમો/ઇજારદારો/વેપારીઓ કે અરજદાર દીઠ અલગ અલગ **રૂ. ૨૫,૦૦૦/-** ડીપોઝીટ સચીન ો સ્ટેશન ખાતે ભરવાની રહેશે. ત્યારબાદ જ હરાજીની બોલીમાં ભાગ લઇ શકશે.

સદરહુ વાહનો નીચે હરાજાની વિગતમાં જણાવ્યા મુજબના સ્થળે રાખેલ છે. જે અરજદાર / ઇજારદાર વેપારીઓ જોઇ શકશે. હરાજીના વાહન જે સ્થીતીમાં હશે તેજ સ્થીતીમાં સુપ્રત કરવામાં આવશે. હરાજી પુર્ણ થયેથી હરાજીમાં ઉચી બોલી બોલનાર ઇસમ પાસેથી સ્થળ ઉપર ૧/૪ રકમ તથા લાગુ પડતા ક્ષની રકમ તુરતજ ભરપાઇ કરવાની રહેશે. હરાજીની શરતો હરાજીના સમયે વાંચી સંભળ

અ. નં.	હરાજીમાં મુ કે લ વાહન ની વિગત	વાહન નંબર	મોડલ	હરાજીમાં મુકેલ વાહનનું સ્થળ	હરાજીની તારીખ અને સમય	હકાઊનું સ્થળ
٩	ટાટા SFC 407 ટેમ્પો	GJ-15-Z- 6815	2008	હોજીવાલા શોપીગ સેન્ટર સામે ખુલ્લા કંમ્પાઉન્ડમાં	ર७/०૯/૨૦૨૨ કલાક-૧૧/૦૦	હોજીવાલા શોપીગ સેન્ટર સામે ખુલ્લા કંમ્પાઉન્ડમાં
5	હોન્ડા સાઇન મો.સા.	GJ-05- FN-9249	2009		//	//

(આર.એલ. માવાણી) મદદનીશ પોલીસ કમિશ્નર "એફ" ડિવિઝન સુરત શહેર

ક્રમાંક ઃ માહિતી-સૂરત/હ૪૮/૨૦૨૨ પણા કંભારીયા શાખા : પ્લોટ નં. ૧૨-૧૩. ટાટા મોટર્સ ઓટ પોઈન્ટની પાસે, મું. મગોબ, તાલુકો - ચોર્યાસી, જીલ્લો - સુરત, પીન-૩૯૫૦૧૦, ફોન નં. ૦૨૬૧-૨૬૪૦૦૨૯, ૨૬૪૦૦૦૩૦.

ક્બજા નોટીસ આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિંક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ તથા સિક્યોરીટી

ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ના નિયમ-૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૪.૦૫.૨૦૨૧ ના રોજ ડીમાન્ડ નોટીસ શ્રી અમિત આસારામ પાટીલ અને શ્રીમતી અલ્કાબાઈ અમૃત પાટીલ અને તેમના જામીનદારો શ્રી દત્તુ સંતોષ વાનખેડે ને નોટીસ માં દર્શાવેલી રકમ રૂા. ૧૨,૯૨,૪૧૦.૮૦ (રૂા. બાર <mark>લાખ બાણું હજાર ચારસો દસ અને સીત્યાસી પૈસા પુરા)</mark> + તા. ૦૪.૦૧.૨૦૨૧ ના રોજ થી વ્યાજ + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરે સાથે કથિન નોટીસ તારીખથી *૬૦* દિવસની અંદર ભરી જવાનો આદેશ કરવામાં આવ્યો

ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ ત્રાપવામાં આવે છે કે અધિનિયમ ૧ ૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ ૨૦૦૨ના રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ **તા. ૦૫.૦૯.૨૦૨૨** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **પ્રત્યક્ષ કબજો** લઇ લીધેલ છે.

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **બેંક ઓફ બરોડા, પુણા** કુંભારીયા શાખા ની ૨કમ રૂા. ૧૫,૧૦,૨૯૯/- (રૂા. પંદર લાખ દસ હજાર બસ્સો નવ્વાણું પુરા) તા. ૦૫.૦૯.૨૦૨૨ સધી ના + ચડત વ્યાજ સાથે + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરેના બોજાને આધીન રહેશે.

સ્થાવર મિલકતનું વર્ણન

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ (૮) તથા કલમ ૧૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો.

શ્રી અમ્રિત આસારામ પાટીલ અને શ્રીમતી અલ્કાબાઈ અમૃત પાટીલના નામની તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતનો **ખુલ્લો પ્લોટ નં. ૧૮૧,** એરીયાનું આશરે ક્ષેત્રફળ ૭૦.૦૦ સ્કે. યાર્ડ. (કેજેપી મુજબનો બ્લોક નં. ૩/૧૮૧, એરીયાનું ક્ષેત્રફળ ૫૮.૫૨ સ્કે.મી.), "આરાઘના લેક ટાઉન વિભાગ - ૨", અવિભાજીત હકક અને હિસ્સા સાથેના રોડુ અને સીઓપીની જમીનના એરીયાનું ક્ષેત્રફળ ૨૫.૬૮ સ્કે.મી., જે સ્થિત બીન ખેતીલાયક જમીનનો રેવન્યુ સર્વે / બ્લોક નં. ૩, ૪, ૫, ૬, ૭, ૮, ૧૦, ૧૨, ૧૯ અને ૩૬૨ (એકત્રીકરણ પછીનો નવો બ્લોક નં. ૩ ફાળવવામાં આવેલ), **ગામ - જોળવા,** સબ જીલ્લો - પલસાણા, જીલ્લો - સુરત. ચતુઃસીમા ઃ- **● ઉત્તરે** ઃ પ્લોટ નં. ૧૮૨, ● દક્ષિણે ઃ પ્લોટ નં. ૧૮૦, ● પૂર્વે ઃ પ્લોટ નં. ૧૯૮, ● પશ્ચિમે ઃ સોસાયટીનો આંતરીક રોડ. સહી/-તારીખ : ૦૫.૦૯.૨૦૨૨, સ્થળ : સરત અધિકૃત અધિકારી, બેં<mark>ક ઓફ બરોડા</mark>

શાહલોન સીલ્ક ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ

રજી. ઓફ.: ૯૧, જુઆઈડીસી, ખટોદરા, સબજેલ પાસે, રીંગરોડ, સુરત-૩૯૫૦૦૨, ગુજરાત. ટેલી : +91-261-419 0200. ઇમેઇલ : info@shahlon.com, વેબસાઇટ: www.shahlon.co ਵੇਤਕ: +91-261-263 5550 | CIN: L17120GJ2008PLC053464

કંપનીની ૧૪મી વાર્ષીક સાધારણ સભા, ચોપડા બંધ કરવા, ડિવિડન્ડ તથા રીમોટ ઈ–વોટીંગ અંગેની માહિતીની નોટીસ

આથી નોટીસ આપવામાં આવે છે કે કંપનીની ૧૪મી વાર્ષિક ("એજીએમ") શુક્રવાર ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ સવરે ૧૧.૦૦ કલાકે વિડીયો કોન્ફરન્સીંગ ("વી.સી.") / અન્ય ઓડીયો વિઝયુઅલ માધ્યમો (''ઓએવીએમ'') દ્વારા ૧૪મી એજીએમ ની નોટીસ જણાવેલ કાર્યો પાર પાડવા માટે યોજાશે. ૧૪મી એજીએમની નોટીસ વર્ષ ૨૦૨૧–૨૦૨૨ ના વાર્ષિક અહેવાલ સાથે જે ડીપોઝીટરી પાટીશીપન્ટો (શેર ડીમેટ મોડમાં ધરાવનારા માટે) કંપની / રજીસ્ટાર અને એજન્ટ બીગશેર સર્વિસીસ પ્રા.લી. (બીગ શેર) (શેર ફીઝીકલ મોડમાં ધરાવનાર માટે) પાસે જે સભ્યોએ તેમના ઈમેઈલ એડ્રેસ રજીસ્ટર્ડ કરાવ્યા છે તેમને ઈમેઈલથી મોકલવામાં આવી છે.

કંપની કાયદા ૨૦૧૩ ની કલમ ૯૧ અને તે હેઠળ ઘડાયેલ નિયમો અને સેબી લીસ્ટીંગ રેગ્યુલેશન્સના નિયમો ૪૨ અંતર્ગત કંપનીના સભ્યોનું નોંધણીપત્ર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક જો ૧૪મી એજીએમ માં શેર હોલ્ડરો દ્વારા મંજુરી મળે તો ૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ પુરા થતા વર્ષના ડીવીડન્ડ માટે હક્કદાર શેરહોલ્ડરો નક્કી કરવાના હેતુસર ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી (બંને દિવસો સહિત) બંધ રહેશે. સભ્યોએ નોંધ લેવી કે બોર્ડ ઓફ ડાયરેક્ટર તેમની ૩૦મી મે ૨૦૨૨ ના રોજ યોજાયેલ બેઠકમાં ૩૧ માર્ચ ૨૦૨૨ના પુરા થતા વર્ષ માટે શેરદીઠ રૂા.૦.૦૬ (૩.૦૦%) ના ડિવીડન્ડની ભલામણ કરી છે. ડીવીડન્ડ જો એ જીએમ માં સભ્યો દ્વારા મંજુરી મળે તો ડિવીડન્ડ ની ચૂકવણી, ડિવીડન્ડ જાહેર થવાના ૩૦ દિવસની અંદર, લાગુ પડતા કરમાળખાનાં નિયમ મુંજબ કપાત કરીને, ચૂકવી દેવામાં આવશે.

ફાઈનાન્સ એક્ટ ૨૦૨૦ મજબ ડીવીડન્ડ ની આવક શેરહોલ્ડરના હાથમાં કરપાત્ર બનશે જે એપ્રિલ ૨૦૨૦ થી લાગુ છે અને કંપની ઈન્ક્રમટેક્ષ એક્ટ, ૧૯૬૧ ("આઈટી એક્ટ") માં જણાવેલ દરો મુજબ સભ્યોની ચુકાવાયેલ ડીવીડન્ડ માંથી કર ("ટીડીએસ") કાપવો આવશ્યક છે. વિવિધ કેટેગરીઓ માટે જણાવેલ દરો શૂન્ય / સવલત વાળા ટીડીએસ ની શરતો અને તેવી જરૂરી વિગતો / દસ્તાવેજો માટે સભ્યોને આઈટી એક્ટ અને આ સંબંધીત એજીએમની નોટીસ જોવા વિનંતી છે. જે સભ્યોને ઈમેઈલ દ્વારા મોકલવામાં આવી છે. કંપની કાયદા ૨૦૧૩ની કલમ ૧૦૮ અને કંપની (વ્યવસ્થાપન અને પ્રાસાશન) નિયમો ૨૦૧૪ ના નિયમો ૨૦ સુધારા મુજબ અને તેની સેબી લીસ્ટીંગ રેગ્યુ લેશન્સના નિયમ ૪૪ અને કંપની સેક્રેટરીસ ઓફ ઈન્ડિયા (આઈસીએસઆઈ) દ્વારા જારી કરાયેલ એસએસ–ર ના એમસીએ પરિપત્રો અને સેબી પરિપત્રો સાથે વાંચન અનુસાર કંપની એજીએમ માં પાર પાડવાના એજીએમની નોટીસમાં જણાવેલ કાર્યો / ઠરાવોના સંબંધમાં તેના સભ્યોને રીમોટ ઈ– વોર્ટીંગની સવલત અને એજાએમ માં ભાગ લેનાર સભ્યો માટે એજાએમ દરમિયાન ઈ-વોર્ટીંગ પધ્ધતિએ મત આપવા માટેની સવલત સીડીએસએલ પુરી પાડી રહી છે

(૧) રીમોટ ઈ–વોટીંગના કાર્ય, એજીએમમાં મતદાન અને એજીએમમાં ભાગ લેવા

તાટેની કટ—ઓફ તા.૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૨ રહેશે. (૨) રિમોટ ઈ–વોર્ટીંગનો સમયગાળો ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (સવારે ૯.૦૦ કલાકે) શરૂ થશે અને ર૯મી સપ્ટેમ્બર, ૨૦૨૨ (સાંજે ૫.૦૦ કલાકે) બંધ થશે. જણાવેલ તારીખ અને સમય પછી રિમોટ ઈ–વોર્ટીંગ માન્ય ગણાશે નહીં

(૩) જે વ્યક્તિનું નામ કટ–ઓફ તારીખના રોજ સભ્યોના નોંધણીપત્રક અથવા ડિપોઝીટરીઓ દ્વારા સંચાલિત લાભાર્થી માલિકોના નોંધણીપત્રકમાં નોંધાયેલ છે ફક્ત તે જ રિમોટ ઈ-વોર્ટીંગ, એજીએમમાં ઈવોર્ટીંગ અને ૧૪મી એજીએમમાં વીસી/ઓએવીએમથી ભાગ લેવા હક્કદાર ગણાશે.

(૪) નોટીસની રવાનગી પછી કંપનીના શેરો પ્રાપ્ત કરનાર અને કંપનીના સભ્ય બનનાર અને કર્ટ–ઓફ તા.ર૩મી સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ શેરો ધરાવતી કોઈપણ વ્યક્તિ હેલ્પડેસ્ક helpdesk.evoting@cdslindia.com પર ઈ-મેલ કરી લોગઈન વિગ્તો અને પાડવર્ડ મેળવીને વોટ કરી શકે છે. જો તમે પહેલેથી જ સીડીએસએલ સાથે રજીસ્ટર છો તો તમારી પાસે રહેલ લોગઈન વિગતો અને પાસવર્ડ દ્વારા વોટ કરી શકો છો.

(૫) જે સભ્યોએ સભા પહેલા રિમોટ ઈ–વોર્ટીગથી તેમના મત આપ્યા છે તે સભામાં પણ હાજર રહી શકે છે પરંતુ ફરીથી તેમના મત આપવા હક્કદાર ગણાશે નહીં.

(૬) કંપનીએ શ્રી ભૈરવ એચ. શુકલા, વ્યવસાયીક કંપની સેક્રેટરી (સીઓપી નં એફસીએસ દર૧૨)ની રીમોટ ઈ–વોર્ટીંગ અને ૧૪મી એજીએમમાં ઈ–વોર્ટીંગના યોગ્ય પારદર્શક રીતે સ્ક્રુટીનાઈઝ કરવા માટે સ્ક્રુટીનાઈઝર તરીકે નિમણુક કરી છે.

વાર્ષીક સમાન્ય સભામાં હાજરી આપવા અંગે કે સીડીએસએલ ઈ–વોર્ટીંગ પધ્ધતિ દ્વારા ઈ–વોર્ટીંગ કરવામાં કોઈપણ પુછપરછ કે વાંધો હોય તો આપ www.evotingindia.com પર ઉપલબ્ધ મેન્યુઅલ અને ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેસ્ચન્સ (એફએક્યુએસ) નો હેલ્પ સેક્શન હેઠળ મી. રાકેશ દલ્વી ને સંબોધી શકો છો અથવા હેલ્પડેસ્ક helpdesk.evoting@cdslindia.com પર મેઈલ લખી શકો છો. અથવા ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૨૫૫૩૩ પર સંપર્ક કરી શકો છો.

આ નોટીસ કંપનીની વેબસાઈટ www.shahlon.com અને સીડીએસએલ ની વેબસાઈટ www.evotingindia.com પર પણ ઉપલબ્ધ છે.

તારીખઃ ૦૮,સપ્ટેમ્બર,૨૦૨૨

શાહલોન સિલ્ક ઈન્ડસ્ટીઝ લિમિટેડના બોર્ડ ઓક ડિરેક્ટર્સ ના આદેશથી હિતેશ કે. ગરમોરા કંપનીના સેકેટરી

૧૧. ૦૧-૦૧-२૦२२ | સ્થળ : સરત-યુકો બેંક.

Inviting offer for sale of unlisted 6% Non-Convertible Redeemable Preference Shares of Rs. 10.00 each of Sumeet Industries Limited, details as under.						
No. of Preference Shares	Face Value	Date of Allotment	Date of Redemption			
4,00,000	10.00	15/11/2013	14/11/2023			
10.00.000	10.00	06/01/2016	05/01/2026			

Shares of face value of Rs. 10/- as above, please mail us on sumeetmenthol@gmail.com with complet details on or before 15th September, 2022 For Siddhipriva Poly Fab Private Limited

🏿 वैक ऑफ़ बड़ौदा Bank of Baroda

પુણા કુંભારીચા શાખા : પ્લોટ નં. ૧૨-૧૩, ટાટા મોટર્સ ઓટો પોઈન્ટની પાસે, મું. મગોબ, તાલુકો - ચોર્યાસી, જીલ્લો - સુરત, પીન-૩૯૫૦૧૦, ફોન નં. ૦૨૬૧-૨૬૪૦૦૨૯, ૨૬૪૦૦૦૩૦

ક્બજા નોટીસ આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ના નિયમ-૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની 3એ તા. ૦૪.૦૫.૨૦૨૧ ના રોજ ડીમાન્ડ નોટીસ **શ્રી જયેશ હસમખભાઈ પટેલ અને શ્રીમતી દાર્મિષ્ઠાબેન જરોશભાઈ પટેલ** ને નોટીસ માં દર્શાવેલી ૨કમ **રૂા. ૧૪,૦૧,૧૧૪.૯૦ (રૂા. ચોદ લાખ એક હજાર** એક્સો ચોદ અને નેવું પૈસા પુરા) + તા. ૧૩.૦૩.૨૦૨૧ ના રોજ થી વ્યાજ + લીગલ અને અન્ય ખર્ચાઓ

વગેરે સાથે કથિન નોટીસ તારીખર્થી ૬૦ દિવસની અંદર ભરી જવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ ૨૦૦૨ના રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ **તા. ૦૫.૦૯.૨૦૨૨** ના રોજ નીચે ૪ણાવેલ મિલકતનો **પ્રત્યક્ષ કબજો** લઇ લીધેલ છે.

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **બેંક ઓફ બરોડા,** પુણા કુંભારીયા શાખા ની રકમ રૂા. ૧૬,૯૯,૩૧૨.૯૬ (રૂા. સોળ લાખ નવ્વાણું હજાર ત્રણસો બાર અને છજ્નું **પૈસા પુરા)** તા. ૦૨.૦૯.૨૦૨૨ સુધી ના + ચડત વ્યાજ સાથે + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરેના બોજાને આધીન રહેશે.

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ (૮) તથા કલમ ૧ ૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો.

શ્રી જયેશ હસમુખભાઈ પટેલના નામની તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનો **પ્લોટ નં. ૨૯૬,** જેનું ક્ષેત્રફળ ૭૨.૦૦ સ્કે. યાર્ડ. એટલે કે ૬૦.૨૮ સ્કે.મી., "રાજમંદિર સોસાચટી", જમીનનો રેવન્યુ સર્વે નં. ૩૬૨ અને ૩૬૪/૧/એ એટલે કે બ્લોક નં. ૨૮૯ અને ૨૮૮ એટલે કે સંયુક્ત નવો બ્લોક નં. ૨૮૮, (કોમ્પ્યુટરાઈઝ્ડ રેવન્યુ રેકોર્ડ મુજબ ઉપરોક્ત પ્લોટ બ્લોક નં. ૨૮૮/૨૯૬ તરીકે ઓળખાય છે), ગામ તાંતીથેચા, તાલુકો - પલસાણા, જીલ્લો - સુરત. ચતુઃસીમા ઃ- 🌢 ઉત્તરે ઃ જોડેનો પ્લોટ નં. ૨૯૫, 🌢 દક્ષિણે જોડેનો પ્લોટ નં. ૨૯૭, ● પૂ**ર્વે** : જોડેની સોસાયટીનો આંતરીક રોડ, ● પશ્ચિમે : જોડેનો પ્લોટ નં. ૩૪૮. સહી/-તારીખ : ૦૫.૦૯.૨૦૨૨, સ્થળ : સુરત અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા

પુણા કુંભારીયા શાખા : પ્લોટ નં. ૧૨-૧૩, ટાટા મોટર્સ ઓટો પોઈન્ટની પાસે, મું. મગોબ, તાલુકો - ચોર્યાસી, જીલ્લો - સુરત, Bank of Baroda પીન-૩૯૫૦૧૦, ફોન નં. ૦૨૬૧-૨૬૪૦૦૨૯, ૨૬૪૦૦૦૩૦. કબજા નોટીસ

આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ના નિયમ-૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ov.ou.રoર૧ ના રોજ ડીમાન્ડ નોટીસ શ્રી તુલસીરામ શંકરભાઇ બોક્ડે અને શ્રીમતી તારાબેન તુલસીરામ બોક્ડે ને નોટીસ માં દર્શાવેલી રકમ રૂા. ૧૦,૨૪,૪૫૪/- (રૂા. દસ લાખ ચોવીસ હજાર ચારસો ચોપ્પન પુરા) + તા. ૨૨.૦૩.૨૦૨૧ ના રોજ થી વ્યાજ + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરે સાથે કથિન નોટીસ તારીખથી go દિવસની અંદર ભરી જવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ આપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) રૂલ ૨૦૦૨ના રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ **તા. ૦૫.૦૯.૨૦૨૨** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **પ્રત્થક્ષ કબજો** લઇ લીધેલ છે.

ઉધારકર્તાને વિશેષ રૂપથી તથા જાહેર જનતાને આથી સદરહુ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન કરવાની યેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **બેંક ઓફ બરોડા, પુણા** કુંભારીયા શાખા ની ૨કમ રૂા. ૧૧,૮૨,૪૪૩.૪૧ (રૂા. અગિયાર લાખ બ્યાસી હજાર ચારસો તેત્તાલીસ અને **એક્તાલીસ પૈસા પુરા)** તા. ૦૨.૦૯.૨૦૨૨ સુધી ના + ચડત વ્યાજ સાથે + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરેના બોજાને આધીન રહેશે.

અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ (૮) તથા કલમ ૧૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો.

શ્રી તુલસીરામ શંકરભાઈ બોકડે અને શ્રીમતી તારાબેન તુલસીરામ બોકડે ના નામનો તમામ ભાગ અને હિસ્સા સાથેની જમીનનો **પ્લોટ નં**. **૩૮૫,** જેનું આશરે ક્ષેત્રફળ ૪૪.૬૨ સ્કે.મી. એટલે કે પ૩.૩૬ સ્કે. યાર્ડ. (કેજેપી મુજબનો બ્લોક નં. ૮૫/૩૮૫, જેનું આશરે ક્ષેત્રફળ ૬૭.૬૫ સ્કે.મી.), અવિભાજીત હકક અને હિસ્સા સાથેના રોડ અને સીઓપી સાથે, **''સાંઇ આંગન રેસીડેન્સી''**, જે સ્થિત જમીનનો બ્લોક નં. ૮૫ (રેવન્યુ સર્વે નં. ૧૦૦ અને ૧૦૧), ગામ - જોળવા, સબ જીલ્લો - પલસાણા, જીલ્લો - સુરત. ચતુઃસીમા :- • ઉત્તરે : જોડેનો પ્લોટ નં. ૩૮૬, ● દક્ષિણો : જોડેનો પ્લોટ નં. ૩૮૪, ● પૂર્વે : જોડેનો સોસાયટીનો આંતરીક રોડ, ● પશ્ચિમે : જોડેનો પ્લોટ નં

તારીખ : ૦૫.૦૯.૨૦૨૨, સ્થળ : સુરત અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા

Bank of Baroda

પુણા કુંભારીયા શાખા : પ્લોટ નં. ૧૨-૧૩, ટાટા મોટર્સ ઓટો પોઈન્ટની પાસે, મું. મગોબ, તાલુકો - ચોર્યાસી, જીલ્લો - સુરત, પીન-૩૯૫૦૧૦, ફોન નં. ૦૨૬૧-૨૬૪૦૦૨૯, ૨૬૪૦૦૦૩૦

કબજા નોટીસ આથી નીચે સહી કરનાર **બેંક ઓફ બરોડા** ના અધિકૃત અધિકારીશ્રીએ સિક્યોરીટાઈઝેશન એન્ડ

રીકન્સ્ટ્રકશન ઓફ ફાઈનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ અધિનિયમ, ૨૦૦૨ તથા સિક્યોરીટી ઈન્ટરેસ્ટ એન્ફોર્સમેન્ટ નિયમો, ૨૦૦૨ના નિયમ-૩ સહિત કલમ ૧૩(૧૨) અંતર્ગત મળેલ સત્તાની રૂએ તા. ૦૪.૦૫.૨૦૨૧ ના રોજ ડીમાન્ડ નોટીસ શ્રી મનોજ નારાયણલાલ અને તેમના જામીનદાર શ્રી દેવાંગ રોહિતકુમાર વખારીયા ને નોટીસ માં દર્શાવેલી ૨કમ રૂા. ૯,૧૧,૪૭૧.૭૦ (રૂા. નવ લાખ અગિયાર **હજાર ચારસો ઈકોત્તેર અને સિત્તેર પૈસા પુરા)** + તા. ૦૫.૦૩.૨૦૨૧ ના રોજ થી વ્યાજ + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરે સાથે કથિન નોટીસ તારીખથી ૬૦ દિવસની અંદર ભરી જવાનો આદેશ કરવામાં આવ્યો હતો. ઉધારકર્તાઓ ઉપરોક્ત રકમ ચુકવવામાં કસુરવાર થતાં આથી ઉધારકર્તાઓ અને જાહેર જનતાને નોટીસ

નાપવામાં આવે છે કે અધિનિયમ ૧૩ની પેટા કલમ (૪) હેઠળ સિક્યરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ૩લ ૨૦૦૨ના રૂલ ૮ અને ૯ સાથે મળેલી સત્તાની રૂએ અધિકૃત અધિકારીએ **તા. ૦૫.૦૯.૨૦૨૨** ના રોજ નીચે જણાવેલ મિલકતનો **પ્રત્યક્ષ કબજો** લઇ લીધેલ છે. . ઉધારકર્તાને વિશેષ ૩૫થી તથા જાહેર જનતાને આથી સદરહ મિલકત અંગે કોઈપણ જાતનો વ્યવહાર ન

કરવાની ચેતવણી આપવામાં આવે છે. સદરહુ સ્થાયી મિલકત અંગે કરેલો કોઈપણ વ્યવહાર **બેંક ઓફ બરોડા,** ા કંભારીયા શાખા ની રકમ કા. ૧૧.૩૨.૩૪૮.૧૨ (કા. અગિયાર લાખ બગીસ હજાર ત્રણ **અને બાર પૈસા પુરા)** + ચડત વ્યાજ સાથે + લીગલ અને અન્ય ખર્ચાઓ વગેરેના બોજાને આધીન રહેશે. ુ અહીં કરજદારનું ધ્યાન આકરુષ્ટ કરવામાં આવે છે તે જણાવેલ સમય મર્યાદામાં પેટા કલમ (૮) તથા કલમ

૧ ૩ સરફેસી એકટ હેઠળ તમો તમારી સુરક્ષિત મિલકતના બાકી લ્હેણાં ભરપાઈ કરી પાછી મેળવી શકો છો.

स्थावर भिलङतनुं वर्धन

શ્રી મનોજ નારાયણલાલ ના નામનો તમામ ભાગ અને હિસ્સા સાથેની મિલકતનો **પ્લોટ નં. ૪૦૩** (કેજેપી મુજબનો બ્લોક નં. ૨૮૮/૪૦૩, એરીયાનું ક્ષેત્રફળ ૪૦.૧૮ સ્કે.મી.), જેનું આશરે ક્ષેત્રફળ ૪૮.૦૦ સ્કે. યાર્ડ. એટલે કે ૪૦.૧૮ સ્કે.મી.. **"રાજમંદિર સોસાચટી"**. જે સ્થિત બીન ખેતીલાયક જમીનનો રેવન્ય સર્વે નં. ૩૬૨ અને ૩૬૪/૧/એ એટલે કે બ્લોક નં. ૨૮૯ અને ૨૮૮ એટલે કે સંયુકત રીતે ફાળવેલ નવો બ્લોક નં. ૨૮૮, **ગામ** · **તાંતીયેચા,** તાલુકો - પલસાણા, જીલ્લો - સુરત. ચતુઃસીમાઃ- 🌑 ઉત્ત**રે** : પ્લોટ નં. ૪૦૪, 👁 **દક્ષિણે** : પ્લોટ નં. ૪૦૨, ● પૂર્વે : પ્લોટ નં. ૩૭૯, ● પશ્ચિમે : સોસાયટીનો આંતરીક રોડ.

અધિકૃત અધિકારી, બેંક ઓફ બરોડા તારીખ : ૦૫.૦૯.૨૦૨૨, સ્થળ : સુરત



ઝોનલ ઓફિસ સુરત, રીદ્ધિ શોપર્સ, સ્ટાર બજાર સામે, અડાજણ હજીરા રોડ, સુરત. ફોન નં. 0261-2797700 E-mail: zo.surat@ucobank.co.in

ઈ-હરાજીથી વેચાણ : તા. 26-09-2022

સિક્યુરીટાઈઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ફાઈનાન્સીયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્યુરીટી ઈન્ટરેસ્ટ એક્ટની કલમ 13(2) અને અન્વયે યુકો બેંકના અધિકૃત અધિકારીએ નીચે જણાવેલ ખાતેદારોને બેંકના નીચે દર્શાવેલ લેણાં વ્યાજ સહિત વસુલ કરવા નોટીસ આપેલ, પરંતુ પછીથી લેણાં ચુકવવામાં નિષ્કળ રહેતા તેમની મિલકતનો કબજો લઈ લીધો છે અને તે મિલકત 'જેમ છે, જ્યાં અને જે છે તેમ છે'ના ધોરણે વેચવાનો અધિકાર ધરાવે છે. જેથી બેંકના લેણાં અને વ્યાજ, અન્ય ખર્ચા જે નીચે પ્રમાણે છે તે વસુલ કરી શકાય. આ અંગે બેંકના નાણાં વસુલ કરતા સરફેસી એક્ટની કલમ રાયે છે. અને સિક્યુરીટી ઈન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) રૂલ્સની કલમ સાથે વંચાણે લેતા મળેલ સત્તાની રૂએ તે મિલકત વેચવા માંગે છે. આ વેચાણ ઈ-હરાજી પ્લેટફોર્મથી વેબસાઈટ https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp પર કરવામાં આવશે.

અ. નં.	કરજદાર/ જામીનદારનું નામ	મિલકતની વિગત	બાકી નીકળતી રકમ કબજાનો પ્રકાર	અનામત કિમત અર્નેસ્ટ મની ડીપોઝીટ	શાખાનું નામ/IFSC કોડ, એકાઉન્ટ નં., સંપર્ક			
1.		મેસર્સ આતિથ્ય હોલીડે રીસોર્ટ પ્રા. લિ. (જામીનદાર), ડીરેક્ટર શ્રી અશ્વિનભાઈ લાલજીભાઈ વિરડીયા જે લાલજીભાઈ આર. વિરડીયાના પુત્ર અને શ્રી નિતીનભાઈ કાનજીભાઈ પટેલના નામે સ્થિત છે, બ્લોક નં. 28, 29, 34 અને 35, રેવન્યુ સર્વે નં. 49, 50, 86 અને 87, "એક્વા સિટી વોટર પાર્ક" આતિથ્ય હોલીડે રીસોર્ટ પ્રા. લિ., સુજેન પાવર પ્લાન્ટ પાસે, ને. હા. નં. 8, ઘાલા ગામ રોડ, મોજે ગામ ધોરણ પારડી, સબ ડિસ્ટ્રી. કામરેજ, જી. સુરત. અંદાજીત માપ આશરે 22119.00 ચો. મી.	રૂા.33,16,19,379.94	₹ι. 8,60,00,000/- ₹ι. 86,00,000/-				
2.		શ્રીમતી રીતાબેન અશ્વિનભાઈ વિરડીયા જે અશ્વિનભાઈ એલ. વિરડીયાના પત્ની નામે સ્થિત છે, પ્લોટ નં. 38, ટી.પી. સ્ક્રીમ નં. 20, કાઈનલ પ્લોટ નં. 19-A & 19-B, ગલાની પાર્ક સોસાયટી, પ્રીયા હોટલ પાસે, વરાછા ચોપાટી ભાગ સામે, નાનાવરાછા, વરાછા મેઈન રોડ, મોજે ગામ નાના વરાછા, તા. સબ ડિસ્ટ્રી. ચોર્યાસી, જી. સુરત. જમીન એરિયા : 52.27 ચો.મી.	રૂા.33,16,19,379.94 પ્રત્યક્ષ	₹1.23,76,000/- ₹1.2,37,600/-				
3.	મેસર્સ આર્યા એક્ષીમ	તમામ ભાગ અને હિસ્સો ધરાવતી મિલકત જે શ્રી હરેનભાઈ લાલજીભાઈ વિરડીયા જે લાલજીભાઈ આર. વિરડીયાના પુત્રના નામે સ્થિત છે, પ્લોટ નં. 39, ટી.પી. સ્ક્રીમ નં. 20, ફાઈનલ પ્લોટ નં. 19-A & 19-B, ગલાની પાર્ક સોસાયટી, પ્રીયા હોટલ પાસે, વરાછા ચોપાટી ભાગ સામે, નાનાવરાછા, વરાછા મેઈન રોડ, મોજે ગામ નાના વરાછા, તા. સબ ડિસ્ટી. ચોર્યાસી, જી. સુરત, જમીન એરિયા: 52.27 ચો.મી.	રૂા.33,16,19,379.94 પ્રત્યક્ષ	₹1.23,76,000/- ₹1.2,37,600/-	MID કોર્પોરેટ, સુરત UCBA0002079 20791015020019 0261- 2791298			
4.		તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકત જે મેસર્સ શ્રેયાંશું જેમ્સ એન્ડ જ્વેલરી, પ્લોટ નં.188/A, રોડ નં.3, બ્લોક/સર્વે નં.388/P & 397/P, સુરત, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, મોજે-સચીન, જી.સુરત.		₹1.36,20,000/- ₹1.3,62,000/-	M-9819544379			
5.		તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકત જે મેસર્સ અસ્તિત્વ એક્ષીમ, પ્લોટ નં.188/C, રોડ નં.3, બ્લોક/સર્વે નં.388/P& 397/P, સુરત, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, મોજે-સચીન, જી સુરત.	રૂા.33,12,46,487.19 પ્રત્યક્ષ	₹1.35,00,000/- ₹1.3,50,000/-				
6.		તમામ ભાગ અને હિસ્સા સહિત મિલકૃત જે મેસર્સ આર્યા એક્ષીમ, યુનિટ 201, પ્લોટ નં.193, બ્લોક/સર્વે નં.396/P, 398/P & 342/P, સુરત, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, મોજે-સચીન, જી.સુરત.	રૂા.33,12,46,487.19 પ્રત્યક્ષ	રૂા.17,60,000/- રૂા.1,76,000/-				
7.	પિંટુકુમાર રમેશભાઈ રાવરાની કાજલબેન પિંટુકુમાર રાવરાની	પ્લોટ નં.597, રો-હાઉસ, નંદીની રેસીડેન્સી-3, રામ વાટીકા પાસે, ટાઉન વેલંજા, તા. કામરેજ, સુરત, ગુજરાત- 394150. જમીન એરિયા: 54.79 ચો.મી., બિલ્ટ અપ એરિયા: 52.98 ચો.મી.	રૂા.12,97,720.09 પ્રત્યક્ષ	રૂા.10,00,000/- રૂા.1,00,000/-	અઠવાલાઈન્સ UCBA0001689 16891015020019 0261-2228938 M-7000189100			
8.	શોભાબેન શિવદાસ ગોસાવી, દિનેશ શિવદાસભાઈ ગોસાવી	રહેઠાણીય ઘર, પ્લોટ નં. 246, અંદાજીત માપ 44.62 ચો.મી., સાંઈ દર્શન રેસીડેન્સી, રેવન્યુ સર્વે નં. 93/1, બ્લોક નં. 121 અંદાજીત માપ 23663 ચો.મી., ગામ બગુમરા, સબ ડિસ્ટ્રી. પલસાણા, જી. સુરત. જે મિલકત શોભાબેન શિવદાસ ગોસાવીના નામે સ્થિત છે.	રા. ૧,4૧,૧6૩.26 પ્રત્યક્ષ	રૂા. 8,48,000/- રૂા. 84,800/-	એમ.જી. રોડ, સુરત UCBA0000017 00171015020019 0261-2423319 M-8866176715 M-6352424836			
	સંપર્ક વિગતો અને સેવા પ્રદાતા વેબસાઇટ સરનામું, મિલકત સંબંધિત કોઈપણ અન્ય ક્વેરી, ઝોનલ ઓક્સિનો સંપર્ક કરી શકે છે. સંપર્ક નં. : 0261-2797700, ઈ-મેઈલ : zo.surat@ucobank.co.in સોમવારથી શનિવાર કામકાજના સમય (સવારે 10:00 થી સાંજે 05:00 કલાક) દરમિયાન બેંક રજાના દિવસ સિવાય સંપર્ક કરી શકે છે.							

ઈ-કરાજીની શરતો અને નિયમો : 1. ઈ-કરાજીની વધુ શરતો માટે બીડરોએ તેમની ઓફર મોકલતા પહેલા અને ઈ-કરાજીમાં ભાગ લેતા પહેલા બેંકની વેબસાઈટ : https://www.mstcecommerce.com/auctionhome/ibapi/index.jsp અથવ www..ibapi.in જોઈ લેવી. 2. ભાગ લેનાર બીર્ડ્સ પાસે માન્ય એક્ટીવ ઈમેઈલ આઈડી અને પાન કાર્ડ હોવો જરૂરી છે. 3. નીચે સહી કરનાર કોઈપણ જાતના કારણ કે નોટીસ આપ્યા વિના ઓકરો સ્વીકારવાનો, નકારવાનો, પાછળ પકેલવાનો કે બાકી રાખવાનો/વૈચાણ રદ કરવાનો, નિયમો અને શરતોમાં ફેરફાર કરવાનો સંપૂર્ણ હક્ક અબાધિત રાખે છે. 4. વેચાણ સરફેસી કાયદા/નિયમો 2002 અને ઉપર જણાવેલ શરતોને આધિન રહેશે. 5. સફળ બિડરોએ ખરીદ કિંમતના 25% (પહેલેથી ચુકવેલ ઈ.એમ.ડી. સહિત) ઈ-હરાજીની પ્રક્રિયા પુરી થયે તે જ દિવસે ભરવાના રહેશે. ખરીદ કિંમતના બાકી 75% રકમ વેચાણ અંગેની પૃષ્ટી આપ્યાના 15 દિવસમાં ભરવાના રહેશે. જેમાં કસુર થયે ડિપોઝીટ જત થશે અને કસુરવાર ખરીદનાર મિલકત અંગેના તમામ કે અન્ય ભાગ માટે ચાર બાદ દાવો કરી શકશે નહીં. 6. અસફળ બિડર્સને ઈ.એમ.ડી. રકમ વેચાણ પ્રક્રિયા પુરી થયે પરત કરવામાં આવશે. 7. વેચાણ બેંકના પૃષ્ટીને આધિન રહેશે, જો દેવાદાર (રો)/જામીનદાર (રો) વેચાણ પહેલા પુરી રકમ ચુકવશે તો વેચાણ રદ કરવામાં આવશે. 8. મારફત દેવાદાર (રો)/જામીનદાર (રો)ને નોટીસ આપવામાં આવે છે કે, ઉપર જણાવેલ લોનની સંપૂર્ણ રકમની બાકી ચુકવણી હરાજીની તારીખ પહેલા ન થશે તો હરાજીની પ્રક્રિયા ઉપર જણાવેલ તારીખે હાથ ધરવામાં આવશે. 9. ઓનલાઈન બીડ ભરવાની છેલ્લી µરીખ:તા.23-09-2022 સાંજે:04.00કલાક સુધી રહેશે. 10. બિર્ડ રજૂ કરવાની કિંમત રિઝર્વ પ્રાઇસથી ઉપરની હોવી જોઇએ અને બોલી વધારાની કિંમત રૂા. 10,000/- રહેશે. 11. ટીડીએસ જો લાગુ પડે તો બીડરે ચુકવવાનું રહેશે સહી/- અધિકૃત અધિકારી, યુકો બેંક.

Manojbhai Laljibhai Mistry at Guardian House, Suman Desai ni Wadi, Udhna Darwaja, Ring Road, Surat-395002 on behalf of Owners Manojbhai Laljibhai Mistry Editor: Manojbhai Laljibhai Mistry

SHAHLON SILK INDUSTRIES LIMITED

Regd. Office: 91, GIDC, Khatodara, B/h. Sub-Jail, Ring Road, Surat - 395 002 Tel No.: .: +91-261-419 0200, E-mail: info@shahlon.com, Website: www.shahlon.com Fax: +91-261-263 5550 | CIN: L17120GJ2008PLC053464

NOTICE OF 14TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, DIVIDEND AND REMOTE E-VOTING INFORMATION NOTICE is hereby given that the 14th Annual General Meeting (AGM) of the members of Shahlon Silk Industries Ltd. will be held on Friday, September 30, 2022 at 11.00 a.m.(IST) through Video Conferencing (VC)/Other Audio Visua Means (OAVM) to transact the business as set out in the Notice of the 14th AGM The Notice calling the 14th AGM along with the Annual Report for the financia year 2021-2022 is sent through electronic mode to those Members whose e mail addresses are registered with Depository Participant (for shareholding in demat mode) or the Company/it's Registrar and Transfer Agent – Bigshare

Services Pvt. Ltd. (Bigshare) (for shareholding in physical mode).
Pursuant to Section 91 of the Companies Act, 2013 and Rules made thereunde and Regulation 42 of SEBI Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company will remain closed from 17th September 2022 to 30th September, 2022 (both days inclusive) for the purpose o determining the shareholders who shall be entitled for dividend for the year ended 31st March, 2022, if approved by the shareholders at the 14th AGM. Members may note that the Board of Directors at its Meeting held on 30th May. 2022 has recommended a Dividend of Re. 0.06/- per share (3.00%) for the year ended 31st March, 2022. The dividend, if approved, by the Members at the AGM, will be paid within a period of 30 days from the date of declaration

subject to deduction of tax at source, wherever applicable.

Pursuant to Finance Act, 2020, dividend income will be taxable in the hands of the shareholders w.e.f. 1st April 2020 and the Company is required to deduct tax at source ("TDS") from dividend paid to the Members at prescribed rates in the Income Tax Act, 1961 ("the IT Act"). For the prescribed rates for various categories, conditions for Nil/preferential TDS and details/documents required thereof, Members are requested to refer to the IT Act and Notice of the

AGM in this regard which is mailed to the members. In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management & Administration) Rules, 2014, as amended and Regulation 44 of SEBI Listing Regulations and SS-2 issued by the Institute of Company Secretaries of India (ICSI) read with MCA Circulars and SEBI Circular the Company is providing remote e-Voting facility to its Members in respect of the business / resolutions as set forth in the Notice of AGM to be transacted a the AGM and facility for those Members participating in the AGM to cast vote through e-Voting system during the AGM provided by CDSL.

(1) The cut-off date for the purpose of remote e-voting, voting at the AGM and for participation in AGM shall be 23rd September, 2022.

(2) The remote e-voting period begins on 27th September, 2022 (9.00 a.m. IST) and ends on 29th September, 2022 (5.00 p.m. IST). Remote E-Voting

shall not be allowed beyond the said date and time.

(3) A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting, e-voting

at the AGM and participating in the 14th AGM through VC/OAVM facility. 4) Any person, who acquires shares of the Company and becomes member of the Company after dispatch of the notice and holds shares as of the cut-of date i.e. 23rd September, 2022, may obtain the login ID and password by sending a request to helpdesk.evoting@cdslindia.com. However, if person is already registered with CDSL for e voting then existing User ID and password can be used for casting vote.

(5) The members who have casted their vote by remote e-voting prior to the meeting may also attend the meeting but shall not be entitled to cast their

vote again. (6) The Company has appointed Mr. Bhairav H. Shukla, Practicing Company

Secretary (Membership No. FCS 6212) as the Scrutinizer to scrutinize the remote e-voting and e-voting at AGM in a fair and transparent manner.

f you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDSL e-Voting System, you may refer the Frequently Asked Questions ("FAQs" and e-voting manual available at www.evotingindia.com, under help section addressed to Mr. Rakesh Dalvi or write an email to helpdesk.evoting@cdslindia.com or call on toll free no. 1800 22 55 33. This Notice is also available on the Company's website www.shahlon.com and on the website of CDSL www.evotingindia.com.

Place : SURAT Date : 08/09/ 2022

authority of the Board of Directors of Shahlon Silk Industries Ltd

VISHVPRABHA VENTURES LIMITED

(Formerly known as Vishvprabha Trading Ltd.) Regd. Office: Ground Floor, Avighna Heights, Survey No. 45-4B, Behind Sarvoday Park, Nandivali Road, Dombivili East 421201 CIN: L51900MH1985PLC034965

Website: www.vishvprabhaventures.com Email: cosec@vishvprabhaventures.com NOTICE OF 38TH ANNUAL GENERAL MEETING, REMOTE

E-VOTING, CUT OFF DATE AND BOOK CLOSURE NOTICE IS HEREBY GIVEN THAT:

Notice is hereby given that the Thirty-Eighth Annual General Meeting (AGM) of the Company will be held through Video Conferencing (VC/ other Annual Visual Means (OAVM) on Friday September 30, 2022 at 2.00 pm, in compliance with applicable provision of Companies Act, 2013 and rules made thereunder and the Securities and Exchange Board of India (SEBI) (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular No. 14/2020 dated April 08, 2020, General Circular No.17/2020 dated April 13, 2020 and General Circular No.20/2020 dated May 5, 2020 and othe applicable Circular issued by Ministry of Corporate Affairs ("MCA") and SEBI (collectively referred to as relevant circular without the physica presence of the member at common venue. Members will be able to attend the AGM through VC/OAVM only Members participating through VC/OAVM facility shall be reckoned for the purpose of quorum unde ection 103 of Companies Act, 2013.

The Annual Report for the financial year 2021-22 including Notice convening the meeting has been sent only through email to members on their registered email ID with the company/RTA on September 08, 2022 and are displayed and available on the website of the Compan at www.vishvprabhaventures.com, website of the Stock Exchanges i.e BSE Limited at www.bseindia.com.

Further, in compliance with provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 (the Act), as amended and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements, Regulations, 2015, the Members are provided with the facility to casi their votes on all resolutions as set forth in the Notice convening the AGM using electronic voting system (e-voting) provided by CDSL. The voting rights of Members shall be proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Friday September 23, 2022 (Cut-off date).

The remote e-voting period shall commence at 9.00 am (IST) or Tuesday, September 27, 2022 and ends at 5.00 pm (IST) on Thursday September 29, 2022. During this period, the members may cast their vote electronically. The voting through remote e-voting shall not be allowed beyond 5.00 pm on Thursday, September 29, 2022. Those members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through evoting system during the AGM. The attendance of the members attending the AGM through VC/OAVM will be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act 2013 The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC OAVM but shall not be entitled to cast their votes again

Members of the Company holding shares as on the cut-off date may cast their votes. Any person who becomes a member of the Company after dispatch of the Notice of the AGM and holding shares as on the cut-off may cast their votes by following the instructions and process of e-voting as provided in the Notice of the AGM. In case Member(s have not registered their e-mail address, they may follow the following

a) Members holding shares in Physical mode are requested to send an e-mail to cosec@vishvprabhaventures.com along with necessary details like Folio No. Name of Member(s) and self-attested scanned copy of PAN Card or Aadhar Card for registering their e-mail address.

b) Members holding shares in demat mode are requested to contact their respective Depository Participant for registering the email address For the details relating to e-voting/remote e voting, please refer to the Notice of the AGM and in case of any queries/grievances pertaining to e-voting/remote e voting, you may refer the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at CDSL website www.evotingindia.com. Under help section or contact Mr. Rakesh Dalvi Manager CDSL, A Wing, 25" Floor, Marathon Futurex, Mafatlal Mills Compounds, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or write an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058738 or 022-23058543 or 022-23058542 during working hours or

Notice is hereby given that pursuant to Section 91 of the Companies Act, 2013 and Regulation 42 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, that the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from Saturday, September 24, 2022 to Friday, September 30, 2022 (both days inclusive) for the purpose of 38th Annual General Meeting.

Thanking You, For Vishvprabha Ventures Limited Jas Raj Nagal

Company Secretary and Compliance officer Place: Dombivali, Thane M No : A59372

For Advertising in **TENDER PAGES** Contact JITENDRA PATIL Mobile No.:

9029012015

Landline No.:

67440215

CANOPY FINANCE LIMITED
CIN: L65910MH1981PLC380399
Registered Office – 301, Corporate Arena Off, Aarrey Piramal X Road, 3rd Floor, Behind
Mahindra Gardens, Goregaon West, Mumbai, Maharashtra, 400 062, Contact: 9867309169 Email: info@canopyfinance.org Email: info@canopyfinance.org

NOTICE OF THE 41ST ANNUAL GENERAL MEETING,
BOOK CLOSURE AND E-VOTING INFORMATION

Notice is hereby given that 41stAnnual General Meeting ("AGM") of Canopy Finance Limited ("the
Company") for the Financial Year 2021-22 is scheduled to be held on Friday, 30th September
2022 at 5.00 p.m. through Video Conferencing (VC) / Other Audio-Visual Means ("OAVM") to
transact the businesses as set out in the Notice convening the AGM ("the Notice") in compliance
with all applicable provisions of the Companies Act, 2013 and the SEBI (LODR) Regulations

with all applicable provisions of the Companies Act, 2013 and the SEBI (LODP) Hegulations 2015 along with all applicable circulars on the matter issued by Ministry of Corporate Affair (MCA) and Securities and Exchange Board of India (SEBI). In compliance with the above MCA and SEBI circulars, the dispatch of electronic copies of Notice of the 41stAGM along with the Annual Report for Financial Year 2021-22 has bee completed on 7th September, 2022 to those Members whose email addresses are registere

with the Company / Depository Participants for communication purpose. Notice of the 41stAGN

with the Company / Depository Participants for communication purpose. Notice of the 41stAGM along with Annual Report for Financial Year 2021-22 will also be available on the Company's website at www.canopyfinance.org, website of the BSE Ltd at www.bseindia.com, website of the Calcutta Stock Exchange Limited at www.cseindia.com and on the website of Central Depository Services (India) Limited at www.evotingindia.com.

Members can join and participate in the AGM through VC/OAVM facility only. The instructions for joining the AGM and the manner of participation in the remote electronic voting or casting vote through the e-voting system during the AGM are provided in the Notice of the AGM. Members participating through the VC/OAVM facility shall be counted for the purpose of reckoning the quorum under Section 103 of the Companies Act, 2013. Members holding shares in physical mode and who have not updated their email addresses with the Company can obtain Notice of AGM. Annual Report and/or login details for joining the AGM through VC/OAVM facility including e-voting by sending scanned copy of (a) Copy of the signed request letter mentioning the folio number, name and address of the Member, (b) Self attested copy of the PAN card and (c) Self attested copy of any document i.e., Aadhar, License, Voter ID, Passport in support of address proof by email to info@canopyfinance.org.

attested copy of any occument i.e., Addinar, License, Voter ID, Passport in support of address proof by email to info@canopyfinance.org.

The Company is pleased to provide to all its members holding shares as on the cut-off date i.e. e23rd September, 2022 with the facility to exercise their right to vote by electronic means ('remote e-voting and e-voting during the AGM) provided by CDSL to transact businesses as set out ir the Notice of AGM. The members holding shares either in physical form or dematerialized form on the cut-off date i.e. Thursday, 23rd September, 2022 may cast their vote electronically to transact the business set out in the Notice of AGM. The remote e-voting period will commence on Tuesday. 27th September, 2022 (9.01 am) and will end on Thursday. 20th September, 2022 (9.01 am) and will end on Thursday. 20th September, 2022 (9.01 am) and will end on Thursday. The members set out in the Notice of Activit. The Interest evening period with committees on Tuesday, 27th September, 2022 (9:00 am) and will end on Thursday, 29th September, 2022 (5:00 pm). The remote voting module shall be disabled thereafter. Once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently. Any person who become member after dispatch of the Notice of the 41st AGM and holding shares as on the cut-off date i.e., 23rd September, 2022 may obtain the User ID and password by sending a request at helpdesk.evoting@cdslindia.com or Company/RTA at support@purvashare.com. he members who have cast their vote by remote e-voting may attend the meeting but shall no

e entitled to cast their vote again. Pursuant to Section 91 of the Companies Act. 2013 read with Regulation 42 of SEBI (LODR

Fursuant to Section 91 of the Companies Act, 2013 read with Regulation 42 of SEBI (LOUR) Regulations, 2015, the Shareholders may note that the Register of Members of the Company will remain closed from 24th September, 2022 to 30th September, 2022 (both days inclusive) for the purpose of 41st AGM of the Company. If you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at toll free no. 1800 22 55 33 or contact the Registrar at support@purvashare.com. he E-voting Results along with Scrutinizers Report shall be available at the websites of the ompany, BSE, CSE and CDSL respectively.

Place : Mumbai

Date: 8th September, 2022 Place: Mumbai

Lalit Kumar Tapadia Managing Director DIN: 08117881

GARODIA CHEMICALS LIMITED

Regd Office: 149/156, Garodia Shopping Centre, Garodia Nagar, Ghatkopar East, Mumbai - 400077

Email ID: gclshares@gmail.com Website: http://www.gchem.org/ CIN NO.: L99999MH1993PLC070321 NOTICE OF 30th ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO

CONFERENCING (VC)/ OTHER AUDIO-VISUAL MEANS (OAVM) The notice is hereby given that the 30th Annual General Meeting ("AGM") of Garodia Chemical imited (The Company) will be held on Friday, 30th September, 2022 at 12.30 PM (IST) through **Video Conferencing**, to transact the Businesses, as set out in the Notice of AGM. The Electronic copies of the Notice of AGM have been sent on 08th September, 2022 to all the members whose email IDs are registered with the Company/Depository Participant(s) as on Friday, 2nd September, 2022 in accordance with the circulars issued by Ministry of Corporate Affairs dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020 and January 13, 2021 along with SEBI circulars dated 12th May, 2020. The same is also available on Bomba

Stock Exchange website https://www.bseindia.com/ Members holding shares either in physical form or in dematerialized form, as on the **cut- off date of Friday, 23 September, 2022** may cast their vote electronically on the Ordinary Business as set out in the Notice of AGM through electronic voting system of NSDL from place other than venue of AGM ("remote e-voting"). All the members are informed that: the Business as set out in the Notice of AGM may be transacted through voting by

electronic means: the remote e-voting shall commence on Monday, 26th September, 2022 at 9:00 AM

the remote e-voting shall end on Thursday, $29^{\rm th}$ September, 2022 at 5:00 PM the cut-off date for determining the eligibility to vote by electronic means or at the AGN

is **Friday, 23 September, 2022** any person, who acquires shares of the Company and become member of the Company after dispatch of the Notice of AGM and holding shares as of the cut-off date Friday, 23 September, 2022 may obtain the login ID and password by sending a request at following email id's: evoting@nsdl.co.in or issuer/RTA.

The remote e-voting module shall be disabled by NSDL after the aforesaid date and time for voting and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently;

The facility for voting at the AGM shall be made available through e-voting by NSDL The members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again;

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting. case of queries, members may refer to the Frequently Asked Questions (FAQs) for

embers and e-voting user manual for members at the Downloads Section of www.evoting.nsdl.com, or email at evoting@nsdl.co.in, Tel: 1800-222-990 or contact he company on email at <u>gclshares@gmail.com</u> who will also address grievances connected with the voting by electronics means.

For and on behalf of Garodia Chemicals Limite

Date: 8th September, 2022

nbers may note that:

Mahesh Garodia Whole time Director DIN: 01250816

Registered office: Plot No.3, Nitco House, Kanjur Village Road, Kanjurmarg (East), Mumbai - 400042. Tel No.: 022 67521555/ Fax: 022 67521500, email: investorgrievances@nitco.in, Website: www.nitco.in, CIN: L26920MH1966PLC016547 NOTICE OF THE 56™ ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

in compliance with applicable provisions of the Companies Act, 2013 ('the Act') and rules made in companies with applicative provisions of the Companies Aut, 2013 (the art at later thereunder, Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements). Regulations, 2015 ('the Listing Regulations') read with Circular No. 14/2020 dated April 08, 2020, Circular No. 17/2020 dated April 13, 2020. Circular No. 20/2020 dated May 05, 2020. Circular No. Collection No. 17/2020 dated April 13, 2020, Sirical No. 20020 dated May 05, 2023, Oilcular No. 20/2020 dated May 05, 2023 (Collectively referred as MCA Circulars) and SEBI Circular No. SEBI/TO. CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 ('SEBI Circular) (MCA Circulars and SEBI Circular) collectively referred as 'Circulars'), NOTICE is hereby given that the Ffity-Sixth (56")Annual General Meeting ('AGM') of the Members of NITCO Limited ('the Company') will be held on Friday, September 30, 2022 at 11:00 A.M. (IST) through Video Conferencing/Other Audio Visual Means ('VC/OAVM'), vithout the physical presence of the Members, to transact the business as set out in the AGM Notice Members attending the AGM through VC/OAVM shall be reckoned for the purpose of quorum under Section 103 of the Act. In compliance with the Circulars, AGM Notice along with the Annual Report for FY 2021-22 ('Annual Report') has been sent only through electronic mode to those Members whose email ids are registered with the Company/Registrar and Transfer Agent ('RTA')/Depository Participant ('DP'). The emailing of AGM Notice to all members has been completed on September 8, 2022. The aforesaid documents are also available on the Company's website at www.nitco.in, websites of the Stock Exchanges i.e. BSE Limited at www.bseindia.com, National Stock Exchange o ndia Limited at www.nseindia.com and on the website of National Securities Depository Limited (NSDL') at www.evoting.nsdl.com. Members whose email ids are already registered with the Company. RTA/DP, may follow the instructions for remote e-Voting as well as e-Voting at AGM as provided in the AGM Notice. Members who have not registered their email ids, are requested to register the same for receiving all communications including Annual Report, Notices etc. from the Company electronically as per process mentioned below. (i) Members who wish to register email id are requested to approach their respective DP and follow the process advised by DP. (ii) Members holding Equity Shares of the Company in physical form may register their details with Link Intime (iii) Alternatively, Members may send a request to evoting@nsdl.co.in for procuring user id and password for e-Voting by providing document as mentioned in the AGM Notice. Pursuant to the provisions of Section 108 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time and Regulation 44 of the Listing Regulations, Members will be provided with the facility to cast their vote electronically, through the remote e-Voting facility (before the AGM) and e-Voting facility (at the AGM), on all the resolutions set forth in AGM Notice. The facility of casting votes will be provided by NSDL. Facility for e-Voting at the AGM will be made available to those Members who are present in the AGM through VC/OAVM facility and have not cast their vote on the resolutions through remote e Voting. The Members who have cast their vote by remote e-Voting prior to the AGM may also attend/ participate in the AGM through VC/OAVM but shall not be eligible to vote at the AGM. All the Members are informed that: 1. the business as set forth in the 56th AGM Notice will be transacted through voting by electronic means in the form of e-Voting. 2. The voting rights of member(s) shall be in proportion to their shares in the paid up equity share capital of the Company as on the cut-off date i.e. Friday, September 23, 2022. A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date, i.e. Friday, September 23 2022 only shall be entitled to vote through remote e-Voting/e-Voting at the AGM. 3. Any person who acquires shares of the Company and becomes member of the Company after sending the notice of the AGM and holding shares as on cut-off date i.e. Friday, September 23, 2022, may obtain the User

ID and password by sending an email to evoting@nsdl.co.in or investorgrievances@nitco.in by mentioning their Folio No./DP ID and Client ID. However, if a person is already registered with NSDL for remote e-Voting then existing user ID and password can be used for casting the votes. 4. The remote e-Voting period begins on Tuesday, September 27, 2022, (09.00 a.m. IST) and ends on Thursday September 29, 2022 (05.00 p.m. IST). The remote e-Voting module shall be disabled b NSDL for voting thereafter. Once the vote on a resolution is cast by the Member, the Member sha not be allowed to change it subsequently. 5. During this period, Members holding shares either in hysical form or in dematerialized form may cast their vote by remote e-Voting before the AGM, 6. The ers will be provided with the facility for e-Voting at the AGM and those Members participating a the AGM & who have not already cast their vote by remote e-Voting before the AGM, will be eligible to vote at the AGM. 7. The Members who have cast their vote by remote e-Voting prior to the AGM may also attend/participate in the AGM through VC /OAVM, but shall not be eligible to vote again at the AGM, 8. Detailed process and manner of remote e-Voting, e-Voting at the AGM and instructions or attending the AGM through VC/OAVM are being provided in the AGM Notice and also available on the Company's website at www.nitco.in and on the website of NSDL at www.evoting.nsdl.com. In case of any queries, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of <u>www.evoting.nsdl.com</u> or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request to Ms. Pallavi Mhatre Manager NSDL at evoting@nsdl.co.in who will also address the grievances connected with the voting by electronic means. 10. The Company has appointed Mr. Ankit Sethi (Proprietor of Ankit Sethi 8 Associates), Practising Company Secretary, as scrutinizer to scrutinize the process for remote e-Voting and e-Voting at the AGM in a fair and transparent manner. 11. The voting results shall be declared within two working days of the conclusion of the AGM and the same, along with the consolidated

(www.evoting.nsdl.com) and shall be communicated to BSE Limited and National Stock Exchange of For Nitco Limited

Scrutinizer's Report, shall be placed on the website of the Company (www.nitco.in), NSDL

Place: Mumbai

Company Secretary & Compliance Officer

केनरा बैंक Canara Bank सिंडिकेट Syndicate

(A GOVERNMENT OF INIDA UNDERTAKING)

ARM-II BRANCH, MUMBAI: 3" Floor, Canara Bank Building, Adi Marzban Street, Ballard Estate, Mumbai - 400 001. •Tel.: 022-22651128 / 29, •Email: cb6289@canarabank.com

SALE NOTICE E-Auction Sale Notice for Sale of Immovable Properties under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) ar Guarantor(s) that the below described Immovable Properties Mortgaged/ charged to the Secured Creditor, the Symbolic Possession of which has been taken by the Authorize Officer of Canara Bank, will be sold on "As is where is", "As is what is" basis on 27.09.202 for recovery of Rs.18,48,60,757.16 (as on 30.06.2022 plus further interest and charge thereon) being dues to Canara Bank ARM II Mumbai Branch from Ws. SPIRO LIFECARE PRIVATE LIMITED, B-208/209, Classique Centre, Plot No. 26, Mahal Industrial Estate, Of Mahakali Caves Road, Andheri (E), Mumbai - 400093, represented by its Directors/ Guaranto Mr. Sanjeev Anant Gupte, Mr. Rajesh Shripad Ghangurde, Mr. Vinod Anant Dali and

Description of the Property	Reserve Price	Earnest Money Deposit
All part and parcel of Land and Building measuring 12000 Sq. Mtr. built up area of 3132.73 Sq. Mtr. at Plot No. F- 1/2, MIDC Jejuri, Additional Jejuri Industrial Area, Near Shalina Laboratories, Jejuri Nira Road, Village Jejuri, Taluka Purandar, Dist. Pune - 421303, Maharashtra along with plant and machineries installed therein in the name of M/s. Spiro Lifecare Pvt. Ltd.	Rs. 11,15,00,000/-	Rs. 1,11,50,000/-

The Earnest Money Deposit shall be deposited on or before 26.09.2022 upto 5.00 p.m. Details of EMD and other documents to be submitted to service provider on or before 26.09.2022 upto 5.00 pm. Date up to which documents can be deposited with Bank is 26.09.2022 upt ma 00.5

Date of inspection of properties with prior appointment with Authorised Officer is 23.09.2022 For detailed terms and conditions of the sale, please refer the link "E-Auction" provided Canara Bank's website (www.canarabank.com) or may contact Mr. Paritosh Kumar, Chie Manager, Canara Bank, ARM II Branch, Mumbai (Ph. No. 022 22651128/ 29/ Mob. No. 8828328297) or Mr. Smit. Jaiswal, Manager, (Mob. No.: 7223002272) E-mail id b6289@canarabank.com during office hours on any working day or the service provider M/s C1 India Pvt. Ltd., Udyog Vihar, Phase - 2, Gulf Petrochem Building, Building No. 301, Gurgaor Haryana. Pin-122015, Mr. Haresh Gowda Mob. No. 9594597555 (Contact No.+911244302020) 21/22 / 23 / 24, support@bankeauctions.com, hareesh.gowda@c1india.com Date: 07.09.2022

Canara Bank, ARM-II Branch

RESPONSIVE

RESPONSIVE INDUSTRIES LIMITED CIN No: L65100MH1982PLC027797 Reg. Office: Betegaon Village, Mahagaon Road, Boisar (East), Taluka Palghar,

Dist. Palghar – 401 501. | **Tel No.:** 022-6656 2821 | **Fax No.:** 022-6656 2798 :mail Id: investor@responsiveindustries.com | Website: www.responsiveindustries.com

NOTICE

otice is hereby given that the 40th Annual General Meeting (AGM) of the Members of the Company will be held on Friday, September 30, 2022 at 02.00 P.M. at Registered Office situated at Betegaon, Mahagaon Road, Boisar East Taluka Palghar, dist. Thane Betegaon MH-401501, to transact the business as set out in the Notice of AGM.

The said Notice and the Annual Report 2021-22 has been sent in electronic mode to th members (other than those who have requested for physical copy) at their e-mail address as registered with the Depository Participant (DP) or the Company. The foresaid document is also available on the website of the Company ww.responsiveindustries.com and on the website of the stock exchanges www.bseindia.com and www.nseindia.com and RTA website at instavote.linkintime.co.in. he members may cast their votes using an electronic voting system from a place oth nan the venue of AGM (remote a-voting). The remote a-voting facility commences from 9.00 a.m. (IST) on Tuesday, 27th September, 2022 and ends at 5.00 p.m. (IST) or hursday, 29th September, 2022. The remote e-voting will not be allowed beyond the oresaid date and time and the voting module will be disabled by Link Intime India Pvt. Ltd. e. LIIPL upon expiry of aforesaid period.

The Members who have not yet registered their email address can send an email <u>nt.helpdesk@linkintime.co.in</u> providing DPID-CLID (16 digit DP ID + CLID or 16 digi eneficiary ID), Name, Client master or copy of consolidated Account Statement, PAN (sel ttested scanned copy of PAN card) Aadhaar (self-attested scanned copy of Aadhaa ard), for receiving Annual Report and log in details for e-voting.

Notice is also given that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Friday, September 23, 2022 to Friday, September 30 022 (both days inclusive) for the purpose of 40th AGM and dividend of the Company embers are hereby informed that:

Date and Time of commencement of remote e-voting: Tuesday, September 27, 2022 09.00 A.M. (IST)

Date and Time of end of remote e-voting: Thursday, September 29, 2022 at 05.00 P.M. Remote e-voting shall not be allowed beyond 5.00 P.M. on September 29, 2022

Cut-off date as on which the right of the Members shall be reckoned: Monday September 02, 2022

Any person who becomes a Member after dispatch of Notice and holding shares as or cut off date i.e. September 02, 2022 may obtain login details by sending request a rnt.helpdesk@linkintime.co or taxation@responsiveindustries.com. The members who have cast their vote by remote a-voting may also attend the AGM bu

will not be entitled to cast their vote again. Once the vote on a resolution is cast by a member, the member will not be allowed to change it subsequently or cast the vo A person whose name is recorded in the Register of Members or in the Register of

Beneficial Owner maintained by the depositories as on the cut off date only shall be entitled to avail facility of e-voting.

For electronic voting instructions, Members may go through the instructions in the Notice of 40th AGM. n case the Members have any queries or issues regarding e-voting, you may refer the

requently Asked Questions ("FAQs") and Instavote e-Voting manual available at https://instavote.linkintime.co.in, under Help section or write an email to notices@linkintime.co.in or Call us: - Tel: 022 - 49186000.

Place : Mumbai Date : September 08, 2022

Company Secretary & Compliance Officer

SUPERTEX INDUSTRIES LIMITED

CIN: L99999DN1986PLC000046

Regd.Office: Plot No.45-46, Phase II, Piperia Industrial Estate, Silvassa (D&NH) Website: www.supertex.in, Email- info@supertex.in, Tel:+91 22-22095630

NOTICE

Notice is hereby given that the 36th Annual General Meeting (AGM) of the Company i scheduled to be held on Friday, the September 30, 2022 at 10.30 am at Plot No.45/46 Phase II, Piperia Industrial Estate, Silvassa (D&NH) to transact the businesses set out i

he Notice of 36th AGM The Register of Members and Share Transfer books of the Company will remain close from Friday, September 23, 2022 to Friday, September 30, 2022 (both days inclusive) for

the purpose of 36th AGM. n view of relaxation given by MCA circulars and SEBI circular, the Notice of the AGM and the Annual report for 2021-22 has been sent by email to those Members whose email

addresses are registered with the Company / Depository Participant(s). The company is providing e-voting facility to its members holding shares as on Thursday September 22, 2022 being cut-off date, to exercise their right to vote on all resolutions se orth in the Notice of AGM. The members may cast their votes using an e-voting system from a place other than the venue of the meeting ("remote e-voting"). The Company has engaged Central Depository Services (India) Limited (CDSL) to provide the remote e-

The remote e-voting period commences on Tuesday, September 27, 2022 at 9 am and ends on Thursday, September 29, 2022 at 5 pm. During this period the members of the Company holding shares in the physical or electronic form as on the cut-off date i.e Thursday, September 22, 2022 may cast their votes electronically.

Any person, who acquires shares of the Company and become Member of the Company after dispatch of the Notice and holding shares as on the Cut-off date i.e Thursday, September 22, 2022 may obtain the login ID and password by sending request at helpdesk.evoting@cdslindia.com. However, if a person is already registered with CDSL for e-voting, then existing User ID and password can be used for casting vote

The Members are also informed that: The remote e-voting shall not be allowed after 5 pm on September 29, 2022.

• The facility for voting through 'Ballot Paper' will be made available at the AGM and the members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to exercise their right at the meeting.

 A member may participate in the AGM even after exercising his right to vote through remote e-voting but shall not be allowed to vote again at the AGM.

· A person whose name is recorded in the Register of Members or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the cut-off date i.e Thursday, September 22, 2022, only shall be entitled to avail the facility of either remote e-voting or voting at the AGM through Ballot form.

The Notice of the 36th AGM is available on the website of the company vi www.supertex.in and on the website of CDSL viz www.evotingindia.com

n case of any Queries or grievances in respect of e-voting, please refer to the Frequentl Asked Questions (FAQs) and the e-voting manual available at www.evotingindia.com c you can write to Mr. Rakesh Dalvi, Sr. Manager, CDSL, Marathon Futurex, A Wing, 25 Floor, N M Joshi Marg, Lower Parel, Mumbai-400013 at the designated email in helpdesk.evoting@cdslindia.com or contact at the toll free no. 1800 22 55 33.

For Supertex Industries Ltd

Mumbai, 8th September, 2022

Vaishali Mungekar Company Secretary

JUMBO FINANCE LIMITED

CIN: L65990MH1984PLC032766

Registered Office: 805, 8th Floor 'A' Wing, Corporate Avenue, Sonawala Road, Goregaon (East), Mumbai-400 063 Telefax: 022-26856703, #email id: jumbofin@hotmail.com, # website: www.jumbofinance.co.in

NOTICE OF 38th ANNUAL GENERAL MEETING, **E-VOTING INFORMATION AND BOOK CLOUSURE**

NOTICE is hereby given pursuant to Section 91 of the Companies Act, 2013 that the Register of Members and the Share Transfer books of the Company would remain closed from Saturday, the 24th September, 2022 to Friday, the 30th September, 2022 (both days inclusive) for the purpose of holding the Annual General Meeting.

NOTICE is also hereby given that the 38th Annual General Meeting (AGM) of the Shareholders of the Company would be held on Friday, the 30th September, 2022 at 11.00 a.m. at the Registered Office of the Company at Office No. 805, 8th Floor, 'A' Wing Corporate Avenue, Sonawala Road, Goregaon (East) Mumbai - 400063.. The printed Annual Report contains, inter alia, the Notice for the said AGM specifying the items of Ordinary business and the audited Accounts of the Company for the year ended 31st March, 2022, together with the Reports of the Auditors and the Directors thereon, is being mailed to all the shareholders whose names appear on the Register of Members and to the Beneficial Holders of Shares as per the details provided by the National Securities Depository Limited and the Central Depository Services (India) Limited.

In compliance with Section 108 of the Companies Act, 2013 and the Companies (Management and Administration) Rules 2014, the Company is pleased to provide its Shareholders with facility to exercise their right to vote for the businesses to be transacted at the 38th AGM by electronic means through E-Voting Services provided by National Securities Depository Limited.

The E-voting period shall commence from Tuesday the 27.09.2022 and ends on Thursday the 29.09.2022. The voting by electronic means shall not be allowed beyond 5.00 p.m. on 29.09.2022. During the e-voting period, Members of the Company, holding shares either in physical or dematerialize form, as on end of the day of business hours 23.09.2022 will be eligible to cast their vote electronically. Once the vote on a resolution is cast by the shareholder, it cannot be changed subsequently.

BY ORDER OF THE BOARD FOR JUMBO FINANCE LTD. SMRITI RANKA MANAGING DIRECTOR

For Responsive Industries Limited

Place: MUMBAL AU SMALL FINANCE BANK LIMITED A SCHEDULED COMMERCIAL BANK Regd. Office: 19-A, Dhuleshwar Garden, Ajmer Road, Jaipur - 302001, Rajasthan, (India). (CIN:L36911RJ1996PLC011381)

Date: 07.09.2022

APPENDIX- IV-A

See proviso to rule 8 (6)]

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES E-auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002. Notice is hereby given to the public in general and in particular to the Borrower /Co-Borrower/ Mortgagor (s) that the below described immovable properties mortgaged to the Secured Creditor, the constructive/physical possession of which has been taken by the Authorised Officer of AU Small Finance Bank Limited A Scheduled Commercial Bank, the same shall be referred herein after as AUSFB. The Secured Assets will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis through E-Auction for recovery of amount mentioned in the table below along with further interest, cost, charges and expenses being due to AUSFB viz. Secured Creditor. It is hereby informed you that we are going to conduct

public E-Auction through website ht	ublic E-Auction through website https://sarfaesi.auctiontiger.net			
Account No. and Name of borrower, Co-Borrower, Mortgagors	Date & Amount as per Demand Notice U/s 13(2) & Date of Symbolic Possession and amount	Descriptions of the Property/Properties	Reserve Price, Earnest Money Deposit & Bid Increment Amount (In Rs.)	E-Auction Date and Time, EMD Submission Last Date, Place of Submission of Bids and Documents, Inspection Date
9001230514708663, 1821212618176063 & 9001231621617331, Mrs. Rekhaben Yogeshbhai Metha (Borrower), Mr. Yogeshbhai Bhanubhai Mehata (Co-borrower/ Mortgagor)	28 September 2021 Rs. 10,16,072.00/- (Rupees Ten Lakh Sixteen Thousand Seventy Two Only), Rs. 11,74,908.00/- (Rupees Eleven Lakh Seventy Four Thousand Nine Hundred and Eight Only) & Rs. 1,18,248.00/- (Rupees One Lakh Eighteen Thousand Two Hundred Forty Eight Only) Collectively Total Amount Rs. 23,09,228/- (Rupees Twenty Three Lakh Nine Thousand Two Hundred and Twenty Eight Only) as on 27 & 28 Sep 2021. Symbolic possession of the property on 09-Dec-21 Rs. 12,09,044/- (Rupees Twelve Lakh Nine Thousand and Forty Four Only), Rs. 13,63,834/- (Rupees Thirteen Lakh Sixty Three Thousand Eight Hundred and Thirty Four Only), Rs. 1,52,788/- (Rupees One Lakh Fifty Two Thousand Seven Hundred and Eighty Eight Only) Collectively Total Amount Rs. 27,25,666/- (Rupees Twenty Seven Lakh Twenty Five Thousand Six Hundred Sixty Six Only) as on 29-August-2022 with further interest & charges	Immovable Property of a Residential House having a land area 139.36Sq. Mtrs. i.e. 166.67Sq. Yards situated at Nana Ramji Mandir street, Old Gamtal area of Jasdan City Survey Sheet No.26, City Survey No. 715&716 Sub Dist. Jasdan Regi. Dist. Rajkot Property owned by Mr. Yogeshbhai Bhanubhai Mehta which is bounded as under- North- Street South- Others Property East- Ramji Temple Street West- Street (Total built-up area on Ground Floor is 1023.00 Sq. Feet) Approx	RESERVE PRICE Rs. 32,00,000/- (Rupees Thirty Two Lakh Only) EMD Rs. 3,20,000/- (Rupees Three Lakhs Twenty Thousand Only) Incremental Amount Rs. 50,000/- (Rupees Fifty Thousand only)	18-October-2022 From 02:00 PM to 04:00 PM to 02:00 PM to 04:00 PM With unlimited extension of Five Minutes Last Date of Bid Submission 17 October 2022 Upto 05:00 PM AU Small Finance Bank Ltd., J1 Complex, 3rd Floor, Beside Pathak School, 150 Feet Ring Road, Rajkot-360005, Gujarat. EmailID: rakesh.jain1@aubank.in Inspection Date 11 & 12 October 2022.

All Interested participants / bidders are requested to visit the website https://sarfaesi.auctiontiger.net & https://www.aubank.in/bank-auction for further details including Terms & Conditions, to take part in e-auction sale proceeding and are also advised to contact Mr. Rakesh Jain, Contact

Number 9116181827 and e-mail of rakesh.jain 1@aubank.in. THIS IS ALSO A STATUTORY 30 DAYS SALE NOTICE UNDER RULE 8(6) OF SECURITY INTEREST (ENFORCEMENT) RULES,2002

STATUTORY 30 DAYS SALE NOTICE TO BORROWER / MORTGAGORS

The terms and conditions of e-auction sale:-

1. The E-Auction sale of Secured Asset is on "as is where is", "as is what is", "whatever there is" and "no recourse" basis for and on behalf of the Secured Creditor viz. AUSFB and there is no known encumbrance which exists on the said property. 2. For participating in online e-auction sale, Bid document copies of PAN Card, Board Resolution in case of Company and photo ID, address proof are required to be submitted along with EMD, which is payable by way of RTGS/NEFT in the name of MSME AUCTION POOL ACCOUNT OF AU Small Finance Bank Limited, Current account No.1921201121711599 AU SMALL FINANCE BANK LIMITED Fifth and Sixth Floor Sunny Big Junction STC Khasra No. 64 to 67 , Gram Sukhaipura New Atish Market Jaipur 302020, IFSC Code: AUBL0002011, Once an Online Bid is submitted, same cannot be withdrawn. Further any EMD submitted by bidder will be required to send the UTR/Ref no of the RTGS/NEFT with a copy of cancelled cheque on the following email IDs i.e. rakesh.jain1@aubank.in

3. All Interested participants / bidders are requested to visit the website https://sarfaesi.auctiontiger.net&https://www.aubank.in/bank-auction for further details including Terms & Conditions, to take part in e-auction sale proceeding and are also advised to contact Mr. Rakesh Jain, Contact Number 9116181827 and e-mail of rakesh.jain1@aubank.in. **Authorised Officer** Date: 08-Sept-2022 Place : Rajkot (Gujarat) **AU Small Finance Bank Limited.**

Ahmedabad